



THE FREE INDOLOGICAL COLLECTION

WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC

FAIR USE DECLARATION

This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.

Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.

If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.

-The TFIC Team.

કર્તાએ સર્વ હુક્ક સ્વાધીન

રાખ્યા છે.

अर्पणपत्रिका.

देवेंद्र पूज्य चरम तीर्थकर श्री
महावीर परमात्मा.

जे मना नामनुं स्मरण्य पशु महा संपदाने वि-
स्तारे छे, जे मनी वाणी आ लवाजिधमां उभिकां
आतां लव्य प्राणीओने नौका समान छे, जे मनुं प-
वित्र चरित्र दृष्टिगोचर थतां वीतरांगपशुं सिद्ध करा-
वे छे, जे मनी सेवा कल्पलता समान छे, तेथी योजे-
श्वरो पशु लेने सदा चाहे छे, जे मनुं दर्शन थतां
तिर्यंचा पशु स्वालाविक वैस्वावने तल्ल हे छे, उप-
द्रव कस्नारां प्राणीओपर पशु जेओ द्यार्द लावे रहे छे,
जे मना शुशुशानडपी अभृत अभर पढी आये छे,
राग रोक्षाजिथी संतप्त थमेलां प्राणीओने शांत क-
रवामां जेओ पुण्यरावर्त मेघ समान छे, अने स्वयं भू-
रभाषु समुद्रनी साथे कडण्डुडपी जगथी स्पर्धा करवा-
वाणा, येवा श्री महावीर प्रज्ञुने नमस्कार करीने तेमना
चरण्यांपुज्मा आ लघु पुरतक समर्पणु करीयो छीओ.

प्रसिद्ध कर्ता.



પ્રસ્તાવનો:

આ જૈન ધર્મ પ્રવેશ પોથીના ખીજ લાગમાં પહેલા લાગથી વધારે ચડીઆતું જ્ઞાન થાય, એ હેતુ રાખીને તેની રચના કરવામાં આવી છે. જે જે વિષયોને માટે પહેલી પોથીમાં ઉપકુમ કરવામાં આવ્યો છે, તે તે વિષયોને વધારે સ્પષ્ટ કરવાના ઈરાદાથી તેના તે વિષયોને પાછા આ પુસ્તકમાં ગોઠવવામાં આવ્યા છે. ગ્રથમ લાગનો અભ્યાસ પૂર્ણ કરી આગળ વધેલા વિદ્યાર્થીઓને આ લાગ સર્વથા ઉપયોગી થશે એમ આશા છે.

આ પુસ્તકને કુયા, ધર્મ, નીતિ અને તત્ત્વ એવા ચાર ખંડમાં વહેંચેલું છે. પહેલા ખંડમાં દર્શન, પૂજા, સામાચિક ને પડિછુકમણુના નાના પાડો ગોઠવેલા છે; ખીજ ખંડમાં દ્વાયા, સત્ય, ચોદ્દી, રાત્રિલોજન, અલક્ષ્ય, હેવ, શુરૂ, ધર્મ વિગેરે પાડો ગોઠવેલા છે; ત્રીજ ખંડમાં હિંમત, ચોખખાઈ, વિનય વિગેરે પાડો ગોઠવેલા છે; અને ચોથા ખંડમાં જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનો માત્ર દુંકો એધ થાય, એવા માત્ર નાના પાડો ગોઠવેલા છે. તે સિવાય તે તે વિષયોને લગતી સહેલી અને મનોરંજક સાહી કવિતાઓ ઉમેરી અભ્યાસીને આનંદ આપે એવી ચોજના કરેલી છે.

આ પુસ્તકમાં આવેલા પાડો સંખ્યી રસૂલ ચિત્રો સ્થળો સ્થળો આપવાનો અમારો વિચાર હતો, અને વાસ્તવિક છે કે તેમ કર્યાથી પુસ્તક બાળકોને વધારે પ્રિય થઈ શકે, પરંતુ ચિત્રો તૈયાર કરવામાં ઘણી વિલંખ થાય એવું લાગવાથી, તથા એજ ડેટલીક અડન્યાણોથી આ એજ આવૃત્તિમાં પણ તેમ કરવા બની શક્યું નથી, હવે આ પુસ્તક જૈનશાળાઓમાં ઉપયોગી થઈ તેની ત્રીજ આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ અમને જલદી મળે, એવી અમો આશા રા-

ખીએ છીએ, કે કે વખતે અમો અમારી ધારણા પ્રમાણે બાળ
કાને તે વધારે ઉપયોગી થવા અમારી વિચાર પાર પાડી શકીએ.

આ પુસ્તક થયા પછી સુનિ મહારાજ શ્રી ૧૦૦૮ ચારિત્રવિ-
જ્યલ્લને શુદ્ધ કરવા માટે અમોએ વિનતિ કરી. તેઓશ્રીએ કૃપા
કરી પુસ્તકને આદિથી અંત પર્યેત તપાસી જોઈ, કે કે વિચાર
કે વાક્યો શ્રી જૈન ધર્મની વિરુદ્ધ લાભ્યાં, તે સર્વે સુધારી આપ્યાં.
તે પ્રમાણે પુસ્તક શુદ્ધ કરી અમોએ છપાયું છે. સુનિ મહા-
રાજશ્રી ચારિત્રવિજ્યલ્લએ આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં ધર્માજ
શ્રમ લઈ સહાય આપી છે, તો તે બાળતું અમો આ પ્રસંગે
તેઓનો મોટો આલાર માનીએ છીએ.

શિવાય અતેની ગુજરાતી તાલુકા સ્કુલના હેડ માસ્ટર શા.
ચાંપશી શુલાખચંદ એઓએ આ પુસ્તકની લાષા શુદ્ધ, સરળ
અને રસીક થાય, તેટલા માટે પુસ્તક વાંચી સુધારી આપ્યું છે, માટે
તેમનો પણ અમો આ પ્રસંગે આલાર માનીએ છીએ. અન્ય જૈન
વિદ્વાન ગૃહસ્થો આ ગૃહસ્થનો દાખલો લઈ વર્ગના કાર્યને સહાય
આપશે એવું અમો દુઃખીએ છીએ.

આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં પ્રથમાવૃત્તિમાં શોઠ ખેતરશી
ખીઅસી તરફથી ઝા. ૫૦૩ની સહાયતા મળી હતી. અન્ય શ્રીમંત.
ગૃહસ્થોને અમાર વર્ગના કાર્યને ઉક્ત શોઢનો દાખલો લઈ, મહદ
કરવા વિનતી કરીએ છીએ.

છેષે એટલું કહીએ છીએ કે, આ પુસ્તક જૈન બાળ
કાને ઉપયોગી થવા માટે તથા લુલ કે દોષથી રહિત કરવા
માટે અમોએ યયારસ્કિત પ્રયત્ન કર્યો છે, છતાં મતુષ્ય પ્રકૃતિના
ધર્મ પ્રમાણે તેમાં કોઈ પણ દોષ માલુમ પડે, તો તે વિદ્વાન
વર્ગ દરશુની કરશે, એવું અમો ચાહું એ છીએ.

પ્રસિદ્ધ કર્તા.

અનુક્રમણિકા.

विषय,

۲۷

અંક ૧ લો.

અંડ રને.

વિષય.

પૃષ્ઠ.

અડ ૩ નો.

હિમત	26
હિમત વિષે ડવિતા	31
વિનય	31
ચોખભાઈ	33
ચોખભાઈ વિષે ડવિતા	34

અડ ૪ થો.

જીવ	36
જીવ અને ઈદ્રિઓ	36
જીવની વિશેષ સમજ	49
અજીવ	43
પુષ્ટયબંધ	46
પુષ્ટય બાંધવાની નવ રીત વિષે ડવિતા...	48
પુષ્ટયતું ક્રૂળ	48
પાપ	50
પાપતું ક્રૂળ	52
આશ્રય	54
સંદર	56
નિર્જરા	58
બંધ	60
કંક્રીટ	62

— — — — —

શી

જૈન ધર્મ પ્રવેશ પોથી

ભાગ ૨ નો.

ખંડ ૧ લો.

પાઠ ૧ લો.

જિન દર્શન.

નિયમચંદ નામનો એક છોકરો હુતો, તે ટેકીલો હુતો,
કેદુપણુ નિયમ દેતો, તે અરોધર પાળતો હુતો; આવી તેનામાં
સારી એવ હુતી, પણ તે ઉતાવળા સ્વલ્લાવનો હુતો. કેદુ
કામ કરે, તો તે ઉતાવળથી કરતો હુતો. જે કામ શરૂ કરે, તેને
તે અડપથી ગમે તેમ પર્તાવી હેતો.

એક વખત નિયમચંદ દેરાસરમાં દર્શન કરવા ગયો, અને
ગ્રાહીજ વારમાં પાછો વળ્યો. તલકચંદ નાસના એક શાવકે
અને તેમ કરતો હીઠો.

તલકચંદ—અદ્યા ! તું ડાનો છોકરો છે ?

નિયમચંદ—હું આવકનો છોકરા છું.

તલકુચંદ—અહીં કેમ આવ્યો હતો ?

નિયમચંદ—દર્શન કરવાને.

તલકુચંદ—આટલી વારમાં તે કેવી રીતે દર્શન કર્યો ?

નિયમચંદ—ભગવાનની સામે એ હુથ જોડી દર્શન કરી લીધાં.

તલકુચંદ—છોકરા ! તું બેધી રીતે જાહ્યા છે, પણ તને દર્શન કરતાં આવડતું નથી.

નિયમચંદ—ત્યારે મને સમજાવો કે તે કેમ કરવાં જોઈએ ?

તલકુચંદ—દર્શનમાં ઉતાવળ કરવી ન જોઈએ. શાંતિ અસે ધીરજથી તે કરવાં જોઈએ. નંયારે આપણે દેરાસરનાં આરણું માં પેસીએ, ત્યારે નિસ્ચીહિ એમ ત્રણ વાર કહેલું. પછી નંયારે ભગવાનની મૂર્તિ નજરે દેખાય, ત્યારે તેને પગે લાગલું, પછી દેરાસરને ત્રણ દેરાઝી ભગવાનની સામે ઉલા રહી સ્તુતિ લણુવી, પછી ત્રણ વાર ખમાસમણુ દેલાં, પછી ચૈલ્યવંદન કર્યું, આવી રીતે કરવાથી દર્શાત કર્યો કહેવાય છે.

નિયમચંદ—ડાડો ! હું તમારો મોટો ઉપકાર માનું છું, આવી રીતે દર્શન કરવાની રીત હવે મારા જણુવામાં આવી. આજથી ધર્મના કામમાં ઉતાવળ કરવાની મારી કુટેવ હું છોડી દઇશ; પણ મને નિસ્ચીહિ એટલે શું ? તે સમજાવશો ?

૨ સંસારનાં કામ નિષેધિને હું દર્શન કરતા આવું છું.

તલકુચંદ—જ્યારે આપણે હેરાસરમાં દર્શન કરવા આવીએ, ત્યારે આપણું ધરનાં કાંઈ પણ કામ સંલારવાં ન જોઈએ, તેને માટે નિસીહિ કહેવાય છે.

આ સંલળી નિયમચંદ ધર્ષેંદ્ર ખુશી થયો, અને તે પછી તે હુમેશાં ઉતાવળ કર્યા વગર વિધિ પ્રમાણે દર્શન કરવા લાગ્યો.

સારથોધ.

કોઈ છોકરાએ નિયમચંદની કેમ ઉતાવળથી હેવડર્શન કરવાં નહિ, અને દર્શનનો વિધિ અરાખર જાણુંબો.

સારાંશ મશો.

- ૧ દર્શન ડેવી રીતે કરવાં ?
- ૨ હેરાસરનાં બારણુંમાં પેસતાં શું બોલવું ?
- ૩ નિસીહિનો અર્થ શું ?

પાઠ ર જો.

જિલ્લાફૂલ.

આપા ! તમે કયાં જાઓ છો ?

હું હેરાસરમાં પૂજા કરવા જઈ છું.

આપા ! મને સાથે તેડી જશો ?

ચાલ, તને પણું પૂજા કરતાં શીખવીશ.

આપા ! ચાલો ત્યારે હું આવું છું.

નો, આ અરિહુંત ભગવાનની પ્રતિમા છે.

આપા ! તેમની પૂજા કેમ કરાય ? તે શીખવો.

પહેલાં નહુદીને ચોખાં લુગડાં પહેરવાં, અને ભગવાનની આશાતના ન થાય, તે માટે મોઢાની આસપાસ લુગડું આંધવું, પછી પ્રતિમાળુને નવરાવવાં, પછી અંગ લુંહણા કરી નવ અંગે તિલક કરવાં, પછી કૂલ ચડાવવાં, અને ધૂપ કરવો, અને પછી પાઠલા ઉપર ચોખાનો સાથીચો કરીને ઉપર ઝણ અને નૈવેદ્ય મૂકવાં, અને નવકારવાળી ફેરવવી, તથા સ્તુતિ ભણવી. આ પ્રમાણે ગ્રબુની પૂજા કરવી જોઈએ.

આપા ! હું મારા જાણવાસાં આંધું; તે પ્રમાણે હું ભગવાનની પૂજા અત્યારેજ કરું છું, અને હું પછી હુમેશાં સવારે એ રીતે પૂજા કરીને પછી જમીશ.

સારથોધ.

આ પ્રમાણે અરિહુંત ભગવાનની પૂજા કરવાની વિધિ જાણી દરેક શ્રાવકના છોકરાએ હુમેશાં ગ્રબુની પૂજા કરવી જોઈએ.

સારાંશ પ્રશ્નો.

૧. લગવાનું ખૂલ કરતી વખતે પહેલાં શું કરવું જોઈએ ?
 ૨. પ્રતિમાળને નવરાત્રીને પછી શું કરવું જોઈએ ?
 ૩. કૂલ ચડાવીને પછી શું કરવું ?
 ૪. ચોખાનો સાથીએ કરીને પછી શું કરવું ?
-

પાઠ ૩ ને.

સામાયિક.

શિવકુંવર—એન વાલખાઈ । તને સામાયિક આવડે છે ?

વાલખાઈ—ના, એન ! અને સામાયિક આવડતું નથી.

શિવકુંવર—આવિકા થઈને સામયિક બાણુતી નથી, ચે
કેવી વાત કહેવાય ?

વાલખાઈ—હું સામાયિક બાણુતી હતી, પણ મને તેમાં
સમજણ પડી નહિ, એટલે મેં તે છોડી દીધું.

શિવકુંવર—તારી ધચ્છા હેઠાં તો તને હું સમજાવું.

વાલખાઈ—એન ! સમજાવ, હું તારો આભાર માનીશ.

શિવકુંવર—સામાયિક કરવાથી ધણો લાલ થાય છે. જે ટલી
વાર સુધી આપણે સામાયિક કરીએ, તેટલી વાર આપણાથી એક
દ્વિતી અરિહંત લગવાનું ધ્યાન થાય છે. જે અંઈ બાણું
ગણું હેઠાં તે પણ શાંતિથી થાય છે. સામાયિકનો અર્થજ સારો

લાલ એવો થાય છે, એટલો સામાયિક કરવાથી ઘણું લાલ મેળવી શકાય છે.

વાલખાઈ—સામાયિક કરતી વખતે કેવી રીતે વર્તવું જોઈએ ?

શિવકુંવર—જેટલો વખત સામાયિક લીધું હોય, તેટલો વખત ઘરના કે ખીજ વહેવારના વિચાર મનમાં આવવા ન જોઈએ. તેટલી વાર તો પોતે વહેવારી નથી, પણ સાધુતામાં છીએ, એમ માનવું જોઈએ. એમ કરવાથી સામાયિકના અધા લાલ મળે છે.

વાલખાઈ—બહાલી બહેન ! હું હુંવે સામાયિકની સતતલખ ખરાખર સમજું આવતી કાલથી સામાયિકની વિધિ શીખવા માંડીશા, અને તારી સાથે હુમેશાં સામાયિક કરવા ઉપાશ્રયે આવીશા.

સારખોધ.

દરેક શ્રાવક શ્રાવિકાએ દરરોજ સામાયિક કરવું, અને વાલખાઈની જેમ સામાયિકનો હેતુ સમજાને તો ખરાખરસ કરવું જોઈએ.

સારાંશ પ્રશ્ના.

૧ શિવકુંવરે સામાયિકને નહી જાણુનારી શ્રાવિકા માટે શું કહ્યું હતું ?

૨ સામાયિક કેવી રીતે કરવું જોઈએ ?

૩ કેટલી વાર સામાયિક કરવું, તેટલી વાર કેમ વર્તવું જોઈએ ?

૪ સામાયિક કરવાથી શો લાસ થાય ?

૫ સામાયિકમાં શું શું થાય છે ?

૬ સામાયિક વખતે કેવા વિચાર ન કરવા જોઈએ ?

પા� ૪ થો.

પડિક્કમણું.

હેમચંદ નામે એક આવક હતો, તે હુમેશાં પડિક્કમણું કરતો, અને પોતાનાં ધરનાં માણસોને પડિક્કમણું કરવાતું કહેતો. તેને પ્રેમચંદ કરીને એક નાનો છોકરો હતો, તેને પડિક્કમણું આવડતું નહિ, તેથી તેને તે શીખવતો હતો. એક વખતે લેણું પૂછ્યું—બાપા ! પડિક્કમણુમાં શું હોય ? તે મને સમજવો.

હેમચંદ—પ્રેમચંદ ! કરેલા પાપથી હઠવું અને તે પા-
પની દેવગુરૂ પાસે મારી ભાગવી તે પડિક્કમણું કહેવાય છે,
એની કિયામાં પહેલું સામાયિક લેવામાં આવે છે, પછી પોતાથી
અને તે પદ્યખાળું લઈ અરિહુંત લગવાનનું ચૈત્યવંદન કરાય
છે, અને શુરૂને વાંદળા આપવામાં આવે છે, તે સાથે કેટલાએક
કાઉસસગ પણ કરાય છે, એને માટે તને આગળ જતાં હું
વધારે સમજવીશ.

એમચંદ—ખાપા ! પડિક્કમણું કરવાથી પાયની સાઝી
મળે છે. તો હુવેથી હું હુમેશાં પડિક્કમણું કરીશા, અને તમારી
પાસેથી જુદી જુદી ખાખતના ખુલાસા લઈશા.

હેમચંદ—દીકરા ! જે તું એમ કરીશા, તો મને ધણો
સંતોષ થશો. અરાખર વિધિ પ્રમાણે રોજ એ વખત પડિક્કમણું
કરવું, એ આપણો ધર્મ છે.

સારબોધ.

દરેક શ્રાવકના છોકરાએ પડિક્કમણું શીખવું અને તેને હેતુ
જાણુંબાને માટે ખુલાસા કરાવી હુમેશાં પડિક્કમણું કરવું.

સારાંશ પ્રશ્નો.

- ૧ હેમચંદ કેવો શ્રાવક હતો, અને તે શું કરતો હતો ?
- ૨ પડિક્કમણુભાસાં શું શું હોય ? તે કહો.

ખંડ રે જો.

પાડું પું મો.

દ્વારા (અહિંસા).

ગંગારામ કરીને એક પ્રાણીણુને છોકરો હતો, તે હુમેશાં લાકડી થઈને ફરતો હતો. જો કેછિ પણ, પક્ષી કો ખીજું પ્રાણી હેણે, તેને તે લાકડીથી મારતો હતો. એક વખતે દ્વારાળું નામનો એક ખીલે છોકરો તેની પાસે થઈને નીકળ્યો. ગંગારામની મારવાની નઢારી ટેવ નોંધને દ્વારાળુચે કહ્યું, ગંગારામ ! આ તું શું કરે છે ? ગંગારામ બોલ્યો, તારે શું કામ છે ? અમારી જેવી મરળું તેમાં અમે કરીએ છીએ. દ્વારાળુચે કહ્યું, ભાઈ ! જરા વિચાર કર. આવું પાયનું કામ ન કરવું નોંધએ. ગંગારામે તોછાઈથી કહ્યું, એમાં શું પાયનું કાસા ? દ્વારાળું બોલ્યો—તારી લાકડી મને આપ, તેનાથી હું તને મારું, તો તને કેવું લાગે ? ગંગારામ બોલ્યો—એથી તો મને વસ્તુ લાગે. દ્વારાળુચે કહ્યું, જેવી રીતે તને વસ્તુ લાગે, તેવી રીતે ખીજાં પ્રાણીને પણ વસ્તુ લાગે કે નહીં ? ખીજાં બધાં પ્રાણી પણ આપણાં જેવાં છે, માટે કેછિ પ્રાણીને હુંઘ આપવું ન નોંધએ. ખીજને હુંઘ હેવાથી ધણું પાપ લાગે છે. ગંગારામ બોલ્યો— લાઈ દ્વારાળું ! તારા કહેવાથી હું મને બરાખર સમજણું પડી.

દેવી રીતે ખીજના મારથી આપણને વસમું લાગે, તેવી રીતે અધાં પ્રાણીને વસમું લાગે, માટે કોઈ પણ જીવને મારવો નહિ, કે ખીજું હુઃખ દેવું નહિ. દ્વારાળુ ! તને આવી સમજણ કાણું પાડી ? દ્વારાળુએ કહ્યું, હું શ્રાવકનો છોકરો છું. અમારા ધર્મમાં જીવદ્યાને માટે બહુ જોધ લખેલો છે. કોઈ પણ જીવને પોતે મારવો નહિ, ખીજની પાસે મરાવવો નહિ, અને ખીજ મારતા હોય, તેને વખાણુવું નહિ. એવી જિન લગ્નવાનની આજા છે. ગંગારામે કહ્યું, લાઈ દ્વારાળુ ! હવેથી હું કદ્દી પણ કોઈ જીવને મારીશ નહિ, અને હુઃખ આપીશ નહિ.

સારખોધ.

દ્વારાળની પેઠે ફરેક શ્રાવકના છોકરાએ પોતાના મતમાં દ્વારા રાખવી જોઈએ, અને ગંગારામની પેઠે ખીજના કહેવાથી પોતાની કુટેવ છોડી દેવી જોઈએ.

સારાંશ પ્રશ્નો.

૧. ગંગારામ કેવો છોકરો હુતો ?

૨. ગંગારામને કેવી ટેવ હુતી ?

૩. દ્વારાળુ કેવો છોકરો હુતો ?

૪. દ્વારાળુએ ગંગારામને શું કહ્યું હતું ? તે કહેણ.

ય દ્વારા જીના કહેવાથી ગંગારામને કેવી અસર થઈ હતી ?
એ જિન લગ્નાની કેવી આજા છે ?

પાઠ ૬ ટો.

જીવ દ્વારા વિષે.

શ્રીપાઠ.

જગમાં જીખું ૧જનમે ૨જાત,
પળમાં ઉપક્રે પળમણે ડાયાત;
પૃથ્વી જળને વાયુ ધાર્ય,
તેમાં ફરતા જાતુ આસ. ૧

શ્રાવક તેની રક્ષા કરે,
જતના સાથે કગલું લરે;
એજ અહિંસા ધર્મ પ્રમાણુ,
એ જિનવરની આજા જાણ. ૨

પાપી હિંસા કરતા કરે,
ધર્મી શ્રાવક તેથી ઉરે;
જીવ દ્વારા પાળક જેહ,
ગણુલા શ્રાવક સધળા તેહ. ૩

૧ પેતા થાય છે. ૨ જીવ. ૩ નાશ પામે છે.

પાઠ ૭ મો.

સત્ય.

અવેરચંદ અને પ્રેમચંદ નામના એ છોકરાએઓ જૈનશાળામાં એકજ વર્ગની અંદર ભણુતા હતા. તેમાં અવેરચંદ જાહી બુદ્ધિનો હતો, અને પ્રેમચંદ ધણો હુશિરાર હતો. અવેરચંદ બુદ્ધિમાં જિતરતો હતો ખરો, પણ તેનામાં એક ગુણુ સારો હતો, તે પોતાના વર્ગમાં માસ્તરની પાસે અને ધરમાં ભાષાપની પાસે કહિ પણ એહું બોલતો નહિ; કે સત્ય હોય તે કહી દેતો હતો. પ્રેમચંદ બુદ્ધિમાં ચતુર હતો, પણ તેનામાં જૂહું બોલવાની કુટેવ હતી. એક વખત માસ્તરે અવેરચંદને પૂછ્યું, અવેરચંદ ! ગઈ કાલે તું કેમ જૈનશાળામાં આવ્યો નહોતો ? અવેરચંદ કહ્યું, સાહેબ ! મને પાઠ આવડતો ન હતો, તેથી હું શાળામાં આવવાને શરમાયો. પછી માસ્તરે પ્રેમચંદને પૂછ્યું, પ્રેમચંદ ! તું ગઈ કાલે શાળામાં કેમ આવ્યો નહોતો ? પ્રેમચંદ એલયો—સાહેબ ! મારે ઘેર કાલે મેમાન આવ્યા હતા; તેથી હું નહોતો આવ્યો. માસ્તરે ફરીવાર પૂછ્યું, તે કાલે પાઠ કર્યો હતો ? પ્રેમચંદ કહ્યું, હા, સાહેબ ! મેં પાઠ કર્યો હતો, માસ્તરે કહ્યું, ત્યારે કાલનો પાઠ બોલી જા. પ્રેમચંદ એલયો—સાહેબ ! અત્યારે મને યાદ નથી. ગઈ કાલે યાદ હતો. આ પ્રમાણે પ્રેમચંદના કહેવાથી તેના માસ્તરના મનમાં આવ્યું કે, આ છોકરો જૂહું બોલે છે, માટે તેને શિક્ષા કરવી. પછી પ્રેમચંદને છેલ્દો એજાર્યો, અને જવેરચંદનાં બહુ વણાણુ કર્યો.

માસ્તરે અધ્યા છોકરાને બિલા કરીને કહું—છોકરાએ !
 તમે અધ્યા આ અવેરચંદનો દાખલો કેનો. તેની જેમ સાચું
 બોલવાની એવ રાખજો. આપણુંથી કદિ અરાણ કામ થઈ ગયું
 હોય, તો પણ જે સાચેસાચું હોય, તે કહી દેવું તેમાં ખાસ
 કરીને પોતાના ધર્મ શુરૂ, શિક્ષક કે માણાપની આગળા તો કદિ
 પણ ખોટું બોલવું નહિ, જે છોકરે સાચું ખાલે છે, તેની
 ઉપર અધ્યા પ્રીતિ રાખે છે. કદિ તેનામાં ખીજ શુણુ હોય, તો
 પણ ખોટું બોલનારની ઉપર અધ્યાને અભાવ થાય છે. આ
 અવેરચંદ મંદ ખુદ્ધિનો છે, તો પણ તે સાચું બોલનારો છે, તો
 તેની ઉપર મને પ્રેમ આવે છે, અને આ પ્રેમચંદ ભણુવામાં
 હુશિયાર છે, પણ તેનામાં જૂદું બોલવાની કુટેવ છે, તેથી મેં
 તેને છેલ્દો કાઢ્યો છે, માટે દરેક છોકરાએ સાચું બોલવાની
 એવ રાખવી.

સારખોધ.

અવેરચંદની જેમ સાચું બોલનારા છોકરાને માન મળે છે,
 અને પ્રેમચંદની જેમ ખોટું બોલનારા છોકરાનું અપમાન થાય છે.

સારાંશ પ્રમેલ.

૧. અવેરચંદ કેવો છોકરે હતો ?

૨. પ્રેમચંદમાં શી કુટેવ હતી ?

૩ જવેરચંદને માન મળવાનું, અને પ્રેમચંદનું અપમાન
થવાનું શું કારણ હતું ?
૪ કોણી કોણી આગણ સાચું ખોલવું જોઈએ ?
૫ છોકરામાં ગુણું હોય, અને સાચું ખોલવાની ટેવ ન
હોય તો, તેના ગુણું કેવા કહેવાય ?

૫૧૮ / મો.

સત્ય વિષે.

દોડરા.

ને શ્રાવકનો સુતાં વદે,^૧ સાચેસાચી વાત,
લાજ વધારી તે અને, લોક વિષે વિખ્યાત.^૨
વિશ્વિતણું^૩ વેવારમાં, છે સાચાનું માન;
સર્વ કરે જન પ્રેમથી, સાચાનું ગુણગાન.^૪
એક સાચાની આંટમાં, લાખ તણું વેપાર;
આંચય ન આવે સાચયમાં, સુધરે આ સંસાર.^૫
જૂડાનું^૬ જગતમાં ધટે, માન અને અપમાન;
મૃધાવાદનાં^૭ યાપથી, તે થાયે હેરાન.^૮
માટે શ્રાવક ધાળ સૈા, ખોલો સાચી વાત;
સત્ય તણું પ્રત ધારીને, સુખ યામો ભલી લાત.^૯

૧ દીકરો. ૨ કહે. ૩ પ્રસિદ્ધ. ૪ જગતના. ૫ હરકત.

૬ ઓઢું ખોલવાના યાપથી.

પાઠ દ મો.

ચોરી.

મોહન—ભાઈ નાથાલાલ ! પાપ કરવાથી શું થાય છે ?
તે તું જણે છે ?

નાથાલાલ—હા, પાપ કરવાથી માણુસ નરકમાં પડે છે.

મોહન—નરકમાં શું હશે ?

નાથાલાલ—નરકમાં પીડા લોગવવી પડે છે.

મોહન—નરકની પીડા તો આપણે જેદી શકતા નથી, પણ
કે આ લોકમાં વેખાય તેવી પીડા પાપથી થતી હશે ?

નાથાલાલ—કેટલાંએક ચેવાં પાપ છે, કે કે કરવાથી આ
લોકમાં અને પરલોકમાં પીડા લોગવવી પડે છે.

મોહન—તેવું પાપ કયું હશે ?

નાથાલાલ—તેવું પાપ ચોરી કરવાથી થાય છે.

મોહન—તે કેવી રીતે ?

નાથાલાલ—ચોરી કરનાર માણુસને આ લોકમાં રાજ
શિક્ષા કરે છે, અને પરલોકમાં નરકની પીડા લોગવવી પડે છે,

મોહન—ત્યારે તો ચોરીનું પાપ આ લોક તથા પરલોકમાં
પણ પડે છે, તે તે ધણું જ નઢાડું પાપ છે.

નાથાલાલ—હા ભાઈ ! ચોરીનું પાપ ધણું જ નઢાડું છે,
પણ ચોરીનો અર્થ તું જણે છે ?

મોહન—તા, હું માણુંતો નથી, મને તે સંમજાવો.

નાથાલાલ—જે કોઈના આખ્યા વિના લઈ લેવું, તે ચોરી કહેવાય છે, અને તે ઉપરથી તેનું ખીંચું નામ આહતાદાન કહેવાય છે.

મોહન—કોઈના આખ્યા વિના લેવાથી એટલું ખંડું પાપ કેમ લાગે ?

નાથાલાલ—પોતાની મનગમતી ચીજને કોઈ ચોરી જાય, એટલે તે ઉપરના રાગને લઈને માણુસનું મન હુખ્યાય છે, અને તેથી ચોરનાર માણુસને પાપ લાગે છે. માટે કોઈઓ કહિ પણ ચોરી કરવી નહિ. ચોરી કરવાથી આ લોકમાં અને પરલોકમાં હુંખી થવાય છે.

મોહન—ભાઈ નાથાલાલ ! હું હું સમજ્યો. હું કહિ પણ ચોરી કરીશ નહિ. આજાં તે મને ખહુ શ્રીખામણની વાત કહી; તેથી હું તારો પાડ માનું છુઃ.

સારબોધ.

મોહનલાલે જેમ નાથાલાલ પાસેથી બોધ લઈ ચોરી ન કરવાનો નિશ્ચય કર્યો, તેમ બધા છોકરાઓએ તેવો નિશ્ચય કરવો લોઈએ.

સારાંશ પ્રશ્નો.

- ૧ મોહને નાથાલાલને પહેલાં શું પૂછ્યું ?
 - ૨ નાથાલાલે તેનો ઉત્તર શો આપ્યો ?
 - ૩ ચોરી કરવાથી કેવી પીડા લોગવવી પડે છે ?
 - ૪ ચોરીનું પાપ કેવું છે ?
 - ૫ ચોરી કરવાથી પાપ શા માટે લાગે ?
 - ૬ મોહને છેવટે શું કહ્યું ?
-

પાઠ ૧૦મો.

ચોરાઈ.

ચોરાઈ.

આપ્યા વિનાનું લેવું જેહ,
સમજે ખાળક ચોરી તેહ;
ધૂપાવી લે પરની ચીજ,
પાપ તણાં તો વાવે થીજ. ૧

ચોરીનાં ઝણ માઠાં હોય,
સહ્યાય કરે નહીં તેને કોય;
ચોરને રાજ આપે દંડ,
ચોર જલાયે ચારે ખંડો. ૨

- ૧ પૃથ્વીના ચારે ખંડમાં.

પાઠ ૧૧ મો.

હેવ.

શિષ્ય—ગુરૂજ ! હેવ કેને કહેવાય ?

ગુરૂ—જેનામાં રાગ અને દ્વેષ ન હોય, તે હેવ કહેવાય છે.

શિષ્ય—રાગ એટલે શું ?

ગુરૂ—કોઈ ઉપર પ્રીતિ રાખવી તે.

શિષ્ય—દ્વેષ એટલે શું ?

ગુરૂ—કોઈ ઉપર ધતરાણ રાખવી, તે દ્વેષ કહેવાય છે. હેવમાં કોઈ જતના હોષ હોતાજ નથી, પણ તે ચાર અતિશયથી ચુક્તા હોય છે. પહેલા અતિશયથી તેમને કોઈ જતના સંક્રાન્ત-હુઃખ નહતાં નથી, બીજા અતિશયથી તેમનામાં બધી જતનું પૂર્ણ જીબ હોય છે, ત્રીજા અતિશયથી તે ત્રણે જગતને પૂળ કરવા ચોય્ય થાય છે, અને ચોથા અતિશયથી તેમનાં વચન બધી ભાષામાં સમજાય છે, અને તે સર્વને હિતકારક લાગે છે.

શિષ્ય—ગુરૂજ ! હું હું હેવના સ્વરૂપને સમજ્યો, અને તેવા હેવ તો શ્રી અરિહંત હેવજ છે, એમ મને આત્મી થઇ.

સારખોધ.

શ્રાવકના ફરેક છોકરાએ પોતાના સાચા હેવને ઓળખી તેમની લક્ષ્ણ કરવી નોઈએ.

સારંશ પ્રશ્ના.

૧ દેવ કેવા હોય ?

૨ દેવમાં શું ન હોય ?

૩ રાગ અને દેવ એટલે શું ?

૪ અતિશાય કેટલા છે ? અને તે ક્યા ક્યા ?

પાઠ ૧૨ મોઃ

ગુરૂ.

અનુપચંદ નામનો એક શ્રાવક ધર્ણા વહેમી હતો. ગામમાં કોઈ આવો કે જતિ આવે, તેને તે શુરૂ તરીકે માનવા હોડી જતો હતો. ધર્ણા ઢાંગી સંન્યાસી, આવાએ અને જતિએ લેને છેતરતા હતા, પછી તે ધર્ણા પરસ્તાવો કરતો હતો. આથી તે કંટાળી ગયો, અને તેણું નિશ્ચય કર્યો કે, આ ફુનિયામાં કોઈ ધર્મમાં અરેખરે શુદ્ધ શુરૂ નથી. એક વખતે તેને શુણુચંદ નામે એક શ્રાવક ભજ્યો, તેની સાથે વાતચિત થતાં અનુપચંદ તેને પૂછ્યું: શેડ ! કોઈ ધર્મમાં સાચા શુરૂ હુશે ? તેણું કહું હા, આપણા કૈન ધર્મમાં સાચા શુરૂ ધર્ણા છે.

અનુપચંદ—સાચા શુરૂને શી રીતે ચોળખવા ?

શુણુચંદ—કોઈ લુલાની હિંસા કરે નહિ, હમેશાં સાચું આલે, ચારી કરે નહિ, અદ્વાર્ય પાળે, અને પોતાની પાસે છાંધી

પરિથિહ રાખે નહિ, એવા પંચમહાવૃત્તધારી હોય, એ સાચા ગુરુ
કહેવાય છે. એમનું શરણુ લેવું જોઈએ.

અનુપચંદ—તમે કહ્યા એવા ગુરુ મને કોઈજ ભળ્યા
નથી, તેથી હું આજ સુધી વહેમમાં લરમાયો, પણ હવે એવા
ગુરુને શરણુ જઈ ધર્મ આદર્શ, કે નેથી માર્દ કલ્યાણ થાય.

ગુણુચંદ—તેવા ગુરુ આપણુ કૈન મુનિઓ હોય છે.

પછી અનુપચંદ એવા કૈન મુનિને શરણુ ગયો, અને તે
ગુરુની લક્ષિતથી ધર્મ પામીને સુખી થયો.

સારખોધ.

અનુપચંદની લેખ. વહેમી. ન થલું, વહેમી થબાથી અરા
ગુરુ ભળતા નથી; અને ગુણુચંદના કેવા સારા શ્રાવકનો સંગ
રાખવો, કે નેથી સાચા ગુરુ સમજની પડે:

સારાંશ પ્રશ્ના.

૧. અનુપચંદ કેવો શ્રાવક હુતો ?
૨. અનુપચંદ શું કરતો હુતો ?
૩. સાચા ગુરુને શી દીતે ઓળખવા ?
૪. સાચા ગુરુ કોણ છે ?



પાઠ ૧૩ મો.

ધર્મ.

છોકરાઓ—ગુરૂજ ! અમારી એક શાંકા દ્વાર કરશો ?

ગુરૂજ—શી શાંકા છે ?

છોકરાઓ—અમે ધર્મ એટલે શુ ? એ ખરાણર સમજલાયનથી, માટે અમને એ વિષે હુંકામાં સમજાવો.

ગુરૂજ—છોકરાઓ ! ધર્મને માટે તમે એટલું સમજલાયા છો ? તે કહો.

છોકરાઓ—અમે તો એટલું સમજાયે છીએ કે, “ સારું કામ જે નીતિ તે ધર્મ ”

ગુરૂજ—ત્યારે તમને શાંકા શી રહે છે ?

છોકરાઓ—કોઈ સારાં કામને ધર્મ કહે છે, કોઈ અવદ્યા પાળવી તેને ધર્મ કહે છે, કોઈ દેહેરે દર્શાન કે પૂજા કરવાનું, એને ધર્મ કહે છે, અને કોઈ સાધુને વાંદવું, એને ધર્મ કહે છે. કહો, તેમાં સાચું શું ?

ગુરૂજ—છોકરાઓ ! તમે જે જે કહું, એ બધું ધર્મમાં આવી જાય છે, પણ ધર્મનો હુંકો અર્થ એવો છે કે, જે નાદારી સ્થિતિમાં પડતા, એવાં પ્રાણીને ધારાણુ કરી અચાવે, તે ધર્મ દેહેવાય છે, તેના પ્રણ પ્રકાર પડે છે. ૧ સાચી વસ્તુનું જાન થયું, ૨ સાચા દેવ, ગુરૂને એણખી તેમાં ડૂચિ થવી, એને ઉં સંસા-

રમાં તથા લ્યાગમણો સાદી વર્તાણું રાખવીઃ આ ત્રણું પ્રકારથી અરાણર ધર્મ સચ્ચવાય છે, વળી નીતિથી વર્તાણું જોઈએ, કેમકે નીતિ એ ધર્મનો યાયો છે.

શૈક્ષણો—ગુરૂજી ! હું એ અમે ધર્મને માટે ડેટલું ક સમજુ ગયા, આપે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે.

સારયોધ.

માણુસે સાચ્ચા ધર્મ ઓળખવો; અને બઢી તે ધર્મ પ્રમાણે ચાલવું.

સારાંશ પ્રશ્ના.

૧ શૈક્ષણોએ શી શાંકા કરી હુતી ?

૨ ધર્મનો કુંડો અર્થ શો ?

૩ ધર્મના ત્રણું પ્રકાર કહો.

પાઠ ૧૪ મો.

ઇશ્વર જગતૂકર્તા નથી.

ખાપા ! આ જગતનો રચનાર કોઈ હુશે કે ?

એટા ! ના, જગતનો અનાવનાર કોઈ છેજ નહીં.

ખાપા ! ખીંઠ ભતના લોકો ઇશ્વરને જગતનો કર્તા માને

છે, અને તચો કહે છે કે, આ જગતું પરમેશ્વરે અન્નાંયું છે,
એનું શું સમજવું ?

એ વાત તદ્દન ખોટી છે. આ જગતું ધારણા કાળથી ચાલ્યું
આવે છે, તેનો કોઈ કર્તા છેજ નહીં.

આપા ! કર્તા વિના કોઈ ચીજ શી રીતે અને ?

એટા ! ત્યારે તો ઈશ્વરનો પણ કંતા હોવો જોઇએ, બણી
એ કર્તાનો કર્તા હોવો જોઇએ; એમ તો પારજ ન આવે.

હા આપા ! એ વાત ખરી છે, જો ઈશ્વર અધી ચીજ અ-
નાવી હોય, તો પછી ઈશ્વર પાપ, અધર્મ, અનીતિ વિગેરે શા માટે
ચ્યાં હે ? બણી કોઈને સુખી, કોઈને હુખ્ખી, અને કોઈને રોગી
શા માટે અનાવે ? જે એવો પક્ષપાત કરે, તો ઈશ્વર અન્યાયી
કરે, માટે હુવે મને નિશ્ચય થયો કે, કોઈ રીતે ઈશ્વર આ જગ-
તનો કર્તા થઈ શકતો નથી. સારાં નડારાં કર્મને લાઇને લાવને
સુખ હુખ્ખ સહ્ય કરે છે.

એટા ! હુવે તું અરાધર સમજયો. તારી આવી સમજણું
જોઇને હું ખુશી થાડિ છું:

સાર ઐધ.

શ્રાવકના દરેક છોકરાએ માનવું કે, જગતનો કોઈ કર્તા
નથી, અને પોતાનાં કરેલાં પાપ હુન્યનો અહલો એની મેળેજ
મહ્યા કરે છે.

સારાંશ અન્ધ્રા.

૧ આ જગતું કેવું છે ?

૨ જગતનો કર્તા કોઈ નથી, તેનું શું કારણું ?

૩ ઈશ્વર જગતનો કર્તા માનીએ, તો શો દોષ આવે ?

૪ જીવ સુઅરી અને દુઃખી શેને લઈને થાય છે ?

પાઠ ૧૫ મો.

રાત્ર ભોજન.

ચંદુલાલ—કેમ ગ્રાણુલાલ ! ઉતાવળો ક્યાં જાય છે ?

ગ્રાણુલાલ—હું જમવાને જરૂર છું.

ચંદુલાલ—આટલો બધો ઉતાવળો કેમ જાય છે ?

ગ્રાણુલાલ—સાંજ પડવા આવી છે, જો હુવે વાર કરું તો
રાત પડી જાય.

ચંદુલાલ—રાત પડે તો શી હુરકત છે ?

ગ્રાણુલાલ—પછી રાત્રે જમાય નહિ.

ચંદુલાલ—રાત્રે શા માટે ન જમાય ?

ગ્રાણુલાલ—અરે ચંદુલાલ ! આવક થઈને આ શું બોલે
છે ? આવકનો દીકરો રાત્રે કંદિ યણું જમે નહિ.

ચંદુલાલ—રાત્રે જમવાથી શું થાય ?

પ્રાણુલાલ—ચંહુલાલ ! રાત્રે જમવાથી પાપ લાગે છે,
તું કોઈ વાર રાતે જમે છે કે ?

ચંહુલાલ—પ્રાણુલાલ ! હું તો ધણી વાર રાત્રે જમું છું.
ઝક્કા મારા ખાપા અને સારી મા જમતાં તથી મારે માટે
છુટ છે.

પ્રાણુલાલ—ચંહુલાલ ! એ થણું ઓઠું કહેવાય. રાત્રે
જમવાથી એકદું પાપ લાગે છે; એટલું જ નહિ, પણ કોઈ વાણ
જીવનું જેણમ થઇ જાય છે.

રાત્રે જીણું જીવજંતુ ધણું થાય છે, તે આપણા ભાણુમાં
પડીને ભરણ પામે છે. વળી કો કોઈ જેરી જીવ સેમાં પડે,
અથવા જોઈ જાય, તે તેથી જીવનું જેણમ થાય છે, સાથે
રાત્રિલોજન કરવું નહિ, એવી જિનહેવની આજા છે.

ચંહુલાલ ! એ ખરી વાત છે, હુવેથી હું કહિ પણ રાત્રિની
લોજન કરીશા નહિ. શ્રાવકના છોકરાએ રાત્રિલોજન વર્જવું જોઈએ.

સારધોધ.

દરેક શ્રાવકની છોકરાએ ચંહુલાલની જેમ રાત્રિલોજન
ન કરવું જોઈએ.

સારાંશ પ્રશ્નો.

- ૧ ગ્રાણુલાલ અને ચંહુલાલ કેવા છોકરા હતા ?
 - ૨ ગ્રાણુલાલ ઉતાર્યણો શા માટે જતો હતો ?
 - ૩ રાન્નિસોજન કરવાથી શા શા જોરક્રાયદા થાય છે ?
 - ૪ ચંહુલાલે આખરે શું કર્યું ?
-

પાઠ ૧૬ મેં.

અભિક્ષય.

ગોવિંદ કરીને એક શ્રાવકનો છોકરો હતો. તે ધણું આઉંઝું હતો. ચૈદ્યામાં જે કંઈ ખાવાની ચીજ ભણે, તે વેચાતી લઈને ખાતો હતો. કોઈ કોઈ વાર તો તેના ખાપની પાસેથી કળુંચો. કરીને પણ ખાવાની ચીજ લેવરાવતો હતો; એવો એ આડિકણું હતો. એક વખતે તે વાડીમાં ફરવા ગયો, ત્યાં કોઈ વેલ ઉપર ધણું ધીવળું એક નાનું ફળ તેના જોવામાં આવ્યું. તેણું તે અનાણ્યું ફળ તોડીને ખાણું, અને થાડી વાર પછી તેના ભાથામાં ધણું ચસકા આવવા લાગ્યા. તે રોતો રોતો ઘેર આવ્યો. તેના ખાપાએ પૂછ્યું, એટા ગોવિંદ ! તું કેમ રડે છે ?

ગોવિંદ—મેં કંઈ અનાણ્યું ફળ ખાધું છે, તેથી મને માંચામાં અહું ચસકા આવે છે; તે ભારાથી ખમાતા નથી.

હસ્તિચંદ—ગોવિંદ ! મેં તને અનાણ્યાં ફળ ખાવાને ધણી

વાર ના કહી છે, તે છતાં તું અજાણ્યાં કૃળ ખાય છે, તેનું આખું પરિણમ આવ્યું.

ગોવિંદ—ખાયા ! મને જલદી કોઈ ઉપાય કરો, માથામાં ધણી પીડા થાય છે, હવેથી હું કહિ પણ અજાણ્યાં કૃળ ખાઈશ નહિ, અને આજથી ખાઉંણું પણ આન્દોલની કુટેવ છોડી દ્યાશા.

પછી તેના ખાયા, એને વૈઘને ઘેરા લઈ ગયા, અને ત્રણું દ્વિસા સુધી દવા કરી, ત્યારે ગોવિંદ સાબો થયો.

આ ગોવિંદનો દાખલો લઈ કોઈ પણ શ્રાવકે અજાણ્યાં કૃળ ખાવાં નહિ, અજાણ્યાં કૃળ અભિક્ષયમાં ગણ્યાય છે. તેમાં ખીજાં ધણું અભિક્ષય છે. કંદ, મૂળ, માંસ, દાડ, વેળણ, પીપરની પેપી, વિગેરે સુખયા છે; જે એકંદર ખાવીશ જતનાં એ અભિક્ષય, વસ્તુ ખાવામાં ધણું પાપ લાગે છે.

સારબોધ.

શ્રાવકના, દીકરાએ અધી જતના અભિક્ષયનો લાગ કરવો જોઈએ. અજાણ્યાં અભિક્ષય કૃળ ખાવાથી ગોવિંદના નેવી વલે થાય છે.

સારાંશ પ્રશ્ના.

૧ ગોવિંદનો ડેવી ટેવ હતી ?

૨ ગોવિંદ શું ખાયું હતું, અને તેથી શું થયું હતું ?

છ અણાણ્યાં ક્રૂળ આવાથી બીજું શું થાય છે ?

જ મુખ્ય અભક્ષ્ય કર્યા ? અને તે એકદર કેટલા છે ?

પાઠ ૧૭ મો.

શ્રાવકના આચાર.

હરિંગિત,

જ કંદ ને વળી ભૂળિએ લીલેતરી બહુ થાય છે,
બહુ બીજ વેગણુ પેપિઓજ અન્તર્કાય ગણ્ણાય છે;
તેમાં ધરે બહુ સ્વાદ નવ દરકાર કરતા જાનની,
નહિ લોકમાં એ રીત એવી કૈનનાં સંતાનની.

રાતે જમે દીવા કરી ધરતા દ્વા નહિ અગમાં,
ધરી લાવ સર્વ અભક્ષ્યનો રહેતા કુસુંગિ સંગમાં;
નહિ પાપ આપ વિચારતા ધર્યા ધરે પણ માનની,
નહિ લોકમાં એ રીત એવી કૈનનાં સંતાનની.

શોભી બની સંસારના જે સાત વ્યસનો સેવતા,
બહુ માની ગમત ગાળમાં અપશણ આપ ઊચારતા;
કરતા કરે છે ધૂન નિર્લેજ નિલ્ય નાટક ગાનની,
નહિ લોકમાં એ રીત એવી કૈનનાં સંતાનની.

૩

ખંડ ઉ બે.

માઠ ૧૮ મો.

હિંમત.

ગલડુ કરીને એક છોકરો હુતો, તે અચયણુમાંથી બીકણુ હુતો. જેમ જેમ તે માટી ઉમ્મરનો થતો ગયો, લેમ લેમ તેમે બીકણુ સ્વભાવ વખતો ગયો. તે ઘોળે દિવસે પણ કોઈ જાયામાં એકલો રહી શકતો નહોતો; તો રતે અધારમાં તો શોનોં રહી શકે ? કોઈ કોઈ વાર તો તે પોતાના પડછાયાથી પણ બીતો હુતો. ચોમાસામાં જ્યારે વીજળી કે ગડગડાટ થાય, ત્યારે તે ગાલરો ણનીને માટી રાડો પાડતો હુતો. કોઈ પણ નાનું મોટું પ્રાણી તેના જોવામાં આવે, અથવા તેના શરીરને જરા વાગે, તો તે પોકે પોકે રહતો હુતો.

ગલડુના આવા બીકણુ સ્વભાવથી તેના ભાણાય કિંગરે અધાં કંઈળી શયાં હુતાં. તે કૈનશાળામાં એકલો લખુવા જઈ શકતો નહિ, તેથી સેના આપને મુડ્યા, અને લેવા જાંબું પડતું હતું. ગલડુના આપના ડેહેવાથી તેના માસ્તરે હિંમતલાલ નામના એક ણહાહર છોકરને તેનો ગોડીયો ઉંધો. હિંમતલાલમાં નામ પ્રાણે શુણુ હુતો, એટલે તેનામાં હિંમત ઘણી હતી. એક વખત

હિંમતલાલે ગલરુને કહ્યું, ગલરુ ! તું મારી સાથે ધણાર ચાલ,
તો તને હિંમત આયું.

ગલરુ—હિંમત શ્રી ચીજ હુશે ? અને તે આપણી પાસે
હોથ તો, શું કામ લાગે ?

હિંમતલાલ—ગલરુ ! જે આપણી પાસે હિંમત હોય,
તો પછી આપણે કોઈનાથી બીજે નહિ.

ગલરુ—ભાઈ હિંમતલાલ ! મને તેવી હિંમત આપ.
કારણ કે, હું ધ્યાન બીજીંણ છું.

હિંમતલાલ—ગલરુ ! તું શૈનાથી બીજે છે ?

ગલરુ—હું ખધાથી બીજા છું.

હિંમતલાલ—શા! માટે બીજે છે ?

ગલરુ—રખે મને કોઈ હુર્કત કરે, એવી મને બીજ
રહ્યાન્ન કરે છે.

હિંમતલાલ—હુવેથી તું તારા મનમાં એવો વિચાર
કરને કે, મને કોઈ હુર્કત કરતાર નથી. બીજને જેમ હુથા
પગ છે, તેમ મારે પણ હાથ પગ છે. જેવી બીજમાં શક્તિ છે,
તેવી મારામાં શક્તિ છે. આવો વિચાર કરવાથી તારા મનમાં
હિંમત આવશે, અને તે હિંમતને લઈને તારા શરીરમાં જેર
આવશે, એટલે તને કોઈની બીજ લાગશે. નહિ..

ગલરુ—હિંમતલાલ ! એ તારું કહેવું ખરું છે, એવા
વિચાર કરવાથી બીજ લાગે નહિં. હુવેથી હું એમજ કરવાની
ટેવ પાડિશા.

હિંમતલાલ—એતું નામજ હિંમત છે. જેનામાં એવી હિંમત હોય, તે માણુસ કોઈનાથી ઉરતો નથી. જેનામાં હિંમત ન હોય, તે માણુસને હુલકામાં હુલકે માણુસ પણ દખાવે છે, એટલું જ નહીં પણ, કોડો તેને નાહિંમત કહી નમાલો ગણે છે, માટે દરેક છોકરાએ હિંમત રાખવી જોઈએ.

ગલરૂ—લાઇ હિંમતલાલ ! હું હું અરાખર સમજયો શું. હું હું કોઈથી ઉરવાનો નથી.

પછી ગલરૂ હુમેશાં હિંમતલાલની સોખતમાં રહીને તેની ચેઠ હિંમતવાળો થયો, અને તેના બાપને તેથી ધણોજ સંતોષ થયો.

સાર ઓધ.

દરેક છોકરાએ હિંમતલાલની જેમ હિંમત રાખવી જોઈએ, અને ગલરૂની જેમ નાહિંમત થવું ન જોઈએ.

સારાંશ પ્રશ્નો.

૧ ગલરૂ કેવો છોકરો હતો ?

૨ હિંમતલાલ કેવો છોકરો હતો ?

૩ ગલરૂને હિંમતલાલની સોખત તેના બાયે શા માટે કરાવી ?

૪ હિંમતલાલે ગલરૂને હિંમત રાખવાને માટે શું કહું હતું ?

૫. ગલર આપણે કેવો છોકરો થયો ?

૬. નાહિં મત થવાથી શો ગેરલાલ છે ?

પાઠ ૧૯ મો.

હિંમત વિષે.

શાખાઈ.

ધરણે હિંમત શ્રાવક બાળ,
હિંમતની છે ડીમત હાલ;
હિંમત લાવે ધર્મ સધાય,
હિંમત કરતાં મળશે સહાય. ૧.

તપસ્યામાં પણ હિંમત હોય,
હિંમતે હારી ઝાવે ન કોય;
હિંમત રાખો વીરતા બાળ,
હિંમત કરવાનો આ કાળ. ૨.

હિંમત ધરવા રાખો પ્રીત,
ઉદ્ય થવાની એ છે રીત;
હિંમતથી સૌ સરશે કામ,
હિંમતથી સૌ રાખો નામ. ૩.

પાઠ ૨૦ મો.

વિનય.

હરિચંદ્ર કરીને એક છોકરો હતો, તેના આપિં વિનય શી-
ખવાને માટે એક સારા પંડિતને સોંપ્યો. હરિચંદ્ર ધણ્ણા ઉછાં-
છેણો હાવાથી તેનામાં વિનય ગુણું નહેતો. અતુર પંડિતે તેને
માટે ધણ્ણી મહેનત કરવા માંડી. હુમેશાં તેને સારી સારી શી-
આમણું આપી, વિનયને માટે સમજાવવા માંડ્યો, તો પણ તે
સમજ્યો નહિ. એક વખતે તે પંડિતની પ્રાડોશમાં એક ધર
તુટી પડ્યું. ધરધણ્ણી તે પંડિતની પાસે ઢોડતો આવ્યો. તેણે
આવી પંડિતને કહ્યું કે, મારું ધર તુટી પડ્યું છે, માટે તેને
આધાર મુકવાને એક લાકડાનો કડકો આપો. પંડિતે તે ધર-
ધણ્ણીને ચેલો ભૂર્ખ છોકરો અતાવીને કહ્યું કે, આ વિનય વગરનો
છોકરો થાંલદા જેવો જર છે, તેને લઈ જાઓ. એ સાંલળી
છોકરે રોવા માંડ્યું, ને કરગરવા લાગ્યો કે, મને લઈ જશો નહિ, મા-
રાથી ધર રાખી શકશો નહિ. મારી ઉપર ધર તુટી પડ્યો, તો હું મરી
જઈશ. આમ ધણ્ણી આજીલું કરી, ત્યારે તે પંડિતે કહ્યું—છોકરા!
તારે થાંલદો થવાને જરું પડશો!

છોકરો—હું થાંલદો થવા શા માટે જરૂર?

પંડિત—જેનામાં વિનય ન હોય, તે માણુસ થાંલદા
જેવો જર જાણ્યો, તું પણ એવો છે માટે?

છોકરો—પંડિતજી ! મને થાંબલો થવા મોકલો નહિ, હું હુવેથી વિનયી થઈશ.

પંડિત—તું વિનય શીખીશ, તો મને સંતોષ થશે.

છોકરો—મને વિનય શીખવવા કૃપા કરો.

પંડિત—હમેશાં શુદ્ધ, માખાપ અને ઓળ જે મોટેરા છાય, હેમની સાથે નમ્રતા રાખવી, અધાની સાથે સહ્યતાથી વર્તવું, અને સૈને મીઠી વાણીથી આલાવવા.

છોકરો—પંડિતજી ! હું આપની આ શીખામણુ કદિ ભૂલીશ નહું. મારામાં અવિનય હુતો, એને માટે માર્ગ કરશો.

પછી વિનય શુદ્ધ શીખીને તે છોકરો ધર્ણો વિનયી થયો, એ જાણીને તેનો આપ ધર્ણો ખુશી થઈ વહુલથી તેને ચોતાને બેર લઈ ગયો.

સારખોધ.

વિનય વગરનો માણુસ થાંબલા જેવો જડ ગણ્ણાય છે. થાંબલોનો તો ધરને ટેકો પણ આપે છે, અને વિનય વગરનો માણુસ તો નકામા જેવો ગણ્ણાય છે. માટે વિનયી થવું જોઈએ.

સારાંશ પ્રશ્નો.

૨ હરિયંદ્રને તેના આપે પંડિત પાસે કેમ મોકદ્યો હુતો ?

૨ પાછિલે તે છોકરાને કેવી ચુક્ષિથી વિનય શીખવ્યે ?
 ૩ હસ્તિચંદ્રને વિનય શીખવાની ભરજી ક્યારે થઈ ?
 ૪ વિનયમાં શું શીખવું જેહાં તે કણી ખતાવો.

પાઠ ૨૧ મો.

ચોખખાઈ.

આ ! આપણું દેરાસરના નોકરે મારું અપમાન કર્યું.

એન ! તેણે તારું શું અપમાન કર્યું વારું ?

આ ! તેણે મને દેરાસરમાં જતાં અટકાવી.

તને શા માટે અટકાવી ?

આ ! એણે મને કહ્યું કે, તું શ્રાવકની દીકરી નથી, પણ
કોઈ બીજી જતાંની છોડી છે, નહીં તો આવી ગંધી હોય કે ?
પછી તેં શું કહ્યું ? એન !

આ ! મેં તેને કહ્યું કે, તું શ્રાવકની દીકરી છું, મારા આપનું
નામ મગજ શેઠ છે, અને મારી ખાતું નામ ધનીયા છે.
પછી તેણે શું કહ્યું ?

તેણે કહ્યું કે, શ્રાવકની દીકરી આવી ગંધી ન હોય. શ્રા-
વકનાં છોકરાં તો ચોખખાં હોય છે, તેઓ પોતાનાં શરીર, લુગડાં
અને વાળ હુમેથાં સાક્ષસુર રાખે છે.

અરી વાત છે. એન ! મેં તને ધણી વાર કહેલું છે કે, તું હુમેશાં ચોખખાઈ રાખજો, તને જોઇને મને પણ શરમ આવે છે. તું કોઈ દિવસ ચોણીને ન્હાતી નથી. મેલાં કપડાં પહોરે છે, તારી આંખોમાં ચીપડા હોય છે, અરાખર દાંતણું કરી મોઢું પણ ધોતી નથી, તારા વાળ ધણું ગંદા રહે છે. તેમાં જૂચો પણ પડેલી હશે. હુવેથી ચોખખાઈ રાખજો. જે તું ચોખખાઈ રાખીશ તો, તારી ઉપર અધાનો પ્રેમ થશે, તને આતાવશે અને તને પાસે એસાડશે.

અહું જ્ઞાન આ ! હુવેથી હું હુમેશાં ચોખખી રહીશ. હું તમ જેવા આખરું દારની દીકરી છું, તે છતાં દેરાસરનો નોકર મને હુલકી જાતની કહે, ચો કેવી શરમની વાત ?

ખરું એન ! પણ જે તું હુવેથી ચોખખાઈ રાખીશ તો, પછી તને કહિ. કોઈ પ્રેમ કહેશે નહિ.

સારબોધ.

શ્રાવકનાં છેકરાંએ ગંડું રહેલું ન જોઇએ. જે તે ગંડાં રહે તો, હુલકી જાતનાં છેકરાંમાં અપે.

સારાંશ પ્રશ્નો.

૧ તે છેકરીને દેરાસરના નોકરે શા ભાટે અટકાવી હુતી ?

૨ શ્રાવકનાં છેકરાં કેવાં હોવાં જોઇએ ?

ગંડા છોકરાં કેવાં હોય છે ?

પાઠ ૨૨ મો.

ચોમખાઈ વિષે.

ચોપાઈ.

બુંધો લાઈ આ જૈતસો બાળ;

કેશર કેરં ચંદ્રન રીખાલ;

ઘેરો સુંદર છે પોશાક,

રવસ્તો જાળુ ચણક રખાપ;

મેલ વિનાના માથે વાળ;

ચોમખાઈમાં છે તેમા ઝ્યાલ;

ચહેરામાં કેવો ચાંડાટ,

સુધડતા રાખે લાલિલાત.

દાતણુ કરવાપર છે અરીત,

ધનિર્ભળ અનીરે ન્હાયે નિત;

રાખે ચોમખાં સરવે દાંગ

ગંડા જુનનો ન કરે સંગ. ૩

૧. કૃપાલ. ૨. લુગડાં. ૩. અરીસા. જેવાં ચણક છે. ૪. મેલ વગરતું.

૫. પાણી. ૬. શરીર.

ખંડ ૪ થો.

પાઠ ૨૩ મો.

જીવ.

મગન કરીને એક છેષકર્તા હતો, તે ઘણો ચાલાક અને હુમેશાં સારા વિચાર કરતાર્દી હતો. તે રોજ કૈન પાઠશાળામાં જાણુવા જતો, અને રસ્તામાં જે કંઈ જીવે તેનો વિચાર કરતો, ને તે વિચારમાં કંઈ શાંકા રહે તો, તે ચોતાના શિક્ષકને પુછી તેનો ખુલાસો મેળવતો હુતો.

એક વખતે તેને રસ્તામાં વિચાર થયો કે, જીવ એ શું હુશો ? તે ભારે જાણુણું જોઈએ. એવું વિચારી રેણુ ચોતાના શિક્ષકની સાથે નીચે પ્રમાણે વાતચીત કરી.

મગન—જીવ કેને કહે છે, સાહેબ ?

શિક્ષક—જેમાં સુખ હુઃખ વિગેરે જાણુવાની શક્તિ હોય, તે જીવ કહેવાય છે.

મગન—જીવથી શું શું થાય છે ?

શિક્ષક—જીવ હોય તો શરીર વધે, ઓરાક લેવાય, તેવડે હોય પગ હુલે આલે, મોઢું હુસે ઓલે, અને જે જીવ ન હોય, તો પગ, હોથ, મોઢું કંઈ કરી શકતાં નથી.

મગન—એ શિવાય ખીલું કાંઈ વધારે સમજવાતું છે ?

શિક્ષક—હા, જીવ હોય તો જીલ ચાએ, શરીરને લાગે, આંખ હેઠે, નાક સુંધે, કાન સાંખળે, અને મન વિચારે, પણું ને જીવ ન હોય, તો તે કાંઈ કરી શકતાં નથી. અધાં નકામાં છુ. આ પ્રમાણે શિક્ષકનું કહેલું સાંખળીને મગન ખુશી થયો.

સારખોધ.

હૃદેક છોડે મગનની પેઠે વિચાર કરવાની ટેવ પાડવી, અને તે વિચાર પોતાના શુરૂની આગળ જથ્થુંવી, તેનો ખુલાસો મળવવો; તેથી પોતાના જ્ઞાનમાં વધારો થાય છે.

સારાંશ મશીન.

૧ મગન કેવો છોડો હતો ?

૨ તેનામાં કેવી ટેવ હતી ?

૩ મગનને શંકા રહેતી, ત્યારે તે શું કરતો ?

૪ મગનને રસ્તામાં કેવો વિચાર થયો હતો ?

૫ જીવ કેને કહેવાય ?

૬ જીવથી શું શું થાય છે ?

૭ જીવ હોય તો જીલ, શરીર, આંખ, નાક, કાન અને મન શું શું કરે ?

પાઠ ૨૪ મો.

જીવ અને ઈદ્રિયો.

જીવો અને ભીખો કરીને એ છોકરા હતા, તેઓ ધણા તોઝાની હતા. જૈનશાળામાં લાણુવા જતા, અને વર્ગમાં સારો નંખર રાખતા, પણ તેમનામાં તોઝાન કરવાની કુટેવ પડી હતી. એક વખતે શાળામાંથી છુટ્યા પ્રણી, તેઓ મેહાનમાં પોતાનાં અંગરખાં કાઢી પવનમાં ઉડાડતા હતા, અને તેની ઉપર માટીનાં ડેઝાં ઉછાળતા હતા, તે વખતે હીરાલાલ નામે એક છોકરા લ્યાં આવી ચડ્યો. તે ધણો ડાહો અને ધર્મી હુતો, તેણે જીવને અને લીખાને ઠપકો આપ્યો, અને કણું કે, તમે જીવહિસા કરો છો, તે પરથી જીવો અને લીખો બંને ખડખડ હુસી પડ્યા.

જીવો—વાર્દ લાઈ હીરાલાલ ! મેં લૂગડું જરા પવનમાં ઉડાડ્યું, અને ભીખાચે માટીનું છેદું ઉછાળ્યું, તેમાં જીવહિસા શેની ?

હીરાલાલ—તે કરવાથી એક ઈદ્રિયવાળા જીવની હિંસા થાય છે.

જીવો—જીવને વળી ઈદ્રિયો હોય, એ વાતે તો અમે આજોજ જાણી. ઈદ્રિય શું ચીજ હુશે વાર્દ ?

હીરાલાલ—આપણું કાંઈ પણું કામું કરવું હોય તો, તે ઈદ્રિયોથી થાય છે, અને તેથી જે કાંઈ પણું કામું કરવાનું સાધન, તે ઈદ્રિયો કહેવાય છે.

લીલો—તે ઈદ્રિયોથી શું શું કામ થાય છે ? અર્ને તે ઈદ્રિયો કેટલી છે, તે સમજવીશ ?

હીરાલાલ—બધી મળીને પાંચ ઈદ્રિયો છે. આપણું આ શરીર તે પછેલી ઈદ્રિય છે, તેનાથી આપણે હાલીએ ચાલીએ છીએ, ખીલુ ઈદ્રિય જીબ છે, તેનાથી આપણે સ્વાદ લઈ શકીએ છીએ, ચીલુ ઈદ્રિય નાડ છે, તેનાથી આપણે સુંધી શકીએ છીએ, ચોથી ઈદ્રિય ઝાંખ છે, તેનાથી આપણે જેઠું શકીએ છીએ, અને પાંચમી ઈદ્રિય કાન છે, તેનાથી આપણે સાંસારી શકીએ છીએ.

લીલો—જીવના કેટલા લેદ છે ?

હીરાલાલ—જીવની બધી મળીને છ જાતિ છે, તે છકાય જોવા નાસ્થી જોળખાય છે. મારીના જીવ તે પૃથ્વીકાય, પાણીના જીવ તે અપૂર્કાય, અભિના જીવ તે તેજકાય, પવનના જીવ તે વાયુકાય, અને જાડપાદાના જીવ તે વંતરસ્પતિકાય. એ જાતિના જીવને એક ઈદ્રિય કહે છે.

જીવો—તે તો છકાયની પાંચજ જાતિ ગણુંવી. છુટી કુઈ જાતિ ? તે કહે.

હીરાલાલ—લાઈ જીવા ! અખીરો થા નહિ. તને તે વિશે પણ સમજવીશ. છકાયગાં છુટી જાતિ વ્રસકાય જીવની છે; ને જીવને એકથી વધારે ઈદ્રિયો હોય, તે વ્રસકાય જીવ કહેવાય

છે; નેટલા જીવ ચાપળે હુલતા ચાલતા જોઈએ છીએ, તો અધા ન્રસકાય જીવ છે.

લીણો—ભાઈ હીરાલાલ ! અમેઓએ એકંદ્રિય જીવની હિંસા શી રીતે કરી ? તે સમજાવ.

હીરાલાલ—તમે કપડાને પવનમાં ઉડાડો છો, તેથી વે પવનના જીવ છે, તે હુણ્ણાય છે, અને માટીનાં ઢેઢાને ઉછાળો છો. તેથી પૃથ્વીકાયના જીવ હુણ્ણાય છે, તેથી તમે જીવહિંસા કરો છો, એ વાત સાચી કે ઓઠી ?

જીવો અને **લીણો**—ભાઈ હીરાલાલ તારે કહેલું બરાણર છે. આજથી હુવે અમે કોઈ વાર પણ તેવી નકારી રમત કરીશું નહીં, તેં અમને પાપ કરતાં અચાંચાં, તેને માટે તારેા અમે ઉપકાર માનીએ છીએ.

સારખોધ.

કોઈ પણ આવકના છોકરાએ જીવા અને ભીખાની જેમ તોક્કાની થવું નહિ, અને તેના જેવા નહારા ચાળા કરીને જીવહિંસાનું પાપ કરવું નહિ. કહિ બુલથી તેવું પાપ કરતા હોઈએ, અને જે હીરાલાલ જેવો જલો ધર્મી છોકરો સમજાવે, તો તે વાત સમજીને કખુલ કરવી, અને તેનો ઉપકાર માનવો. કહિ છોકરો ભણુવામાં સારા હોય, પણ તોક્કાની હોય તો, તે સારા ગણ્ણાતા નથી.

સારાંશ પ્રક્રોચ્છા.

- ૧ જીવો અને ભીણો કેવા છોકરા હતા ?
 - ૨ તેમનામાં કેવી કુટેવ પડી હતી ?
 - ૩ હીરાલાદ કેવો છોકરા હતો ? અને તેણે જીવા તથા ભીણાને શું કહ્યું હતું ?
 - ૪ જીવને કેટલી ઇદ્રિયો હાય છે ?
 - ૫ ઇદ્રિય એટલે શું ?
 - ૬ અધી ઇદ્રિયોનાં નામ અને તેનાથી શું શું કામ થાય છે ? તે સમજાવો.
 - ૭ જીવની અધી મળીને કેટલી જાતિ છે ?
 - ૮ તે છ જાતિ કેવાં નામથી એણાણાય છે, અને તેનાં જુદાં જુદાં નામ શું થાય ? તે કહો.
 - ૯ ગ્રસકાય એટલે શું ?
 - ૧૦ એકેંદ્રિય જીવ કોણું ?
-

પાઠ ૨૫ મો.

જીવની વિરોધ સમજ.

મોહન—ખાપા ॥ આ ણાગામાં મોટા પાંજરાજેલું શું છે ?

ખાપા—ખાઈ ॥ તે જીવોનું સંઘર્ષથાન છે.

મોહન—તેમાં શું હુશે ?

ભાપા—તેમાં જતજતના ત્રસ લુવો છે.

મોહન—ત્યારે તેમાં શું જોવાનું છે ? ચાલો આપણે

થેર જઈએ.

ભાપા—આમ શું ખોલે છે ? તેમાં તો ધ્રણું જોવાનું છે. આપણા શ્રાવક ધર્મભાં લુલ વિચારનું જોનું તો જરૂર મેળવવાનું છે.

મોહન—ભાપા ! હું, એ વાત હંરી. ચાલો આપણે જોઈએ. પણ ભાપા ! મને તસે સસ્યાનથણો :

ભાપા—ખુલ્લું સારું, તને તે કિષે હું સારી રીતે સમજાવીશ.

મોહન—ભાપા ! આ પાણીના કુંડામાં કેવો લુલ છે ?

ભાપા—શાખદા, કોડીઓ, ગંડોળા, જોણા, અગસીયાં અને પોરા વિગેરે જગ્ના લુલ છે. તેમને શરીર અને લુલ ખેજ દ્વારા હોય છે. તેથી તે બેદુદ્ધિય કહેવાય છે.

મોહન—ભાપા ! આ હારથાંધ ચાલ્યા જાય છે, તે ક્યા લુલ છે ?

ભાપા—તે માંકોડા, કીડીઓ, જૂં, ઉઘેઈ, ધીમેલ, ગીંગોડા, ગફૈયાં, ધનેડા, કંથલા, અમે એળ વિગેરે લુલ છે; તેમને શરીર, લુલ અને નાડું એ ત્રણ દ્વારા હોય છે, તેથી તેદ્વિય લુલ કહેવાય છે.

મોહન—ખાપા ! આ ખાનામાં કેવી જીતના લુક ઉડે છે ?

ખાપા—તે લમરા, લમરી, ટીડ, મચ્છરી, ડાંસ અને કુસાદી વિગેર લવ છે; તેમને શરીર, લલ, નાક અને વાંઝો એં ચાર ઈદ્રિયો છે તેથી તે ચૈારિંદ્રિય લવ કહેવાય છે.

મોહન—ખાપા ! આ મોટાં પણ, પણી છે, તેઓ કેવા લવ કહેવાય ?

ખાપા—તે બધા પાંચ ઈદ્રિયવાળા લવ કહેવાય છે. તેમનામાં શરીર, લલ, નાક, આંખ અને કાતું એ પાંચ ઈદ્રિયો છે.

મોહન—ખાપા ! ત્યારે આપણે કઈ જીતના લવ કહેવાઈએ ?

ખાપા—આપણે બધા પાંચ ઈદ્રિયવાળા લવ કહેવાઈએ.

મોહન—ખાપા ! હવે મને બરાબર સમજણું પડી. આ જીવના સંબ્રહસ્થાનમાંથી પણ મને સારો આધ થયો. તેથી હું તમારો આલાર માનું છું. આ બધા વસ્તુલવ કહેવાય છે, ખર્દું કે ખાપા !

ખાપા—હા લાઈ.

સારણોધ.

છેઠીરાએ દરેક વદ્દું ઉપર વિચાર કર્યો, કેખી મોહનને

નેમ જીવના સંગ્રહસ્થાનપરથી સારો બોધ થયો, તેમ બોધ થાય,
મોહને પોતાના ખાપને નેમ આલાર માન્યો હતો, તેમ દરેક
છીકરાએ પોતાને બોધ કરાવનારનો આલાર માનવો.

સારાંશ અન્નો.

- ૧ એ ઈદ્રિયોવાળા જીવને એ ઈદ્રિયો કઈ હોય ?
 - ૨ ચોઢને એ ઈદ્રિયવાળા જીવ જોયા હતા, તે કયા જીવ ?
 - ૩ તેરિંદ્રિય જીવને કઈ કિંદુ ઈદ્રિયો હોય ?
 - ૪ તેરિંદ્રિય જીવ કયા ? તેનાં નામ આપો.
 - ૫ ચૈારિંદ્રિય જીવને કઈ કિંદુ ચાર ઈદ્રિયો હોય ?
 - ૬ ચૈારિંદ્રિય જીવનાં નામ આપો.
 - ૭ પંચિંદ્રિય જીવ કયા ? અને તેમની પાંચ ઈદ્રિયો
કઈ ? તે ગણ્યાવો.
 - ૮ આ પાઠમાં કયા જીવોની વાત છે ?
-

પાઠ રદ્દ મો.

અજીવ.

મોતીચંદ અને નિયમચંદ નામના એ ખાળ વિદ્યાર્થીઓ
દરરોજ જૈન પાઠશાળામાં સાથે લાણુતા હતા. મોતીચંદ ડાઢ્યા
અને બુદ્ધિમાનું હતો, અને નિયમચંદ જરસ મંડા બુદ્ધિવાળો.

હुતો. પાડશાળાને શિક્ષક જ્યારે તેમને સમજાવતો, ત્યારે મોતીચંદ તરત બ્રહ્મણ કરી હેતો, અને નિયમચંદના મગજમાં તે વાત ઉત્તરતી નહોતી.

એક વખતે તે ખંને શાળામાંથી છુલ્યા, લારે તેમની વૃદ્ધ્યે નીચે પ્રમાણે વાતચીત થઈ.

નિયમચંદ—લાઈ મોતીચંદ ! આજે આફ્યાસમાં તું શું સમજ્યો ? તે કહો.

મોતીચંદ—લાઈ નિરામચંદ ! આજે તો અળુવ ઉપર આપણું શિક્ષકે સારુ સમજાયું, અને મારા મનમાં તે બચાવર હુંચી પણ ગયું.

નિયમચંદ—લાઈ ! હું તો તેમાં કાંઈ પણ સમજ્યો નથી. મને મહેરણાની કરીને સમજલવીશ ?

મોતીચંદ—ઘણી ખુશીથી. તું મારો મિત્ર છે, વળી તને સમજલવાથી મને ધણો લાભ થશે. કારણું, આપણું માર્સતરે એક વખત કદ્યું હતું કે ખીજને લણવલું, એ પોતાને લણવા વેચું છે. ઓછા લાઇ ! તને કે ન સમજાયું હોય, તે પુછ.

નિયમચંદ—યહેલાં અળુવ એટલે શું ? તે કહો.

મોતીચંદ—નેમાં વધવાની શક્તિ ન હોય, તે અળુવ કહેવાય છે.

નિયમચંદ—અળુવના કેટલા લેદ છે ?

મોતીચંદ—અળુવના પાંચ લેદ છે.

નિયમચંદ—તેનાં નામ અને સમજૂતી આપો.

મોતીચંદ—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય,
પુદ્ગલાસ્તિકાય, અને કાળ—એવાં તેનાં નામ છે. જેમાં પૂરણુથ-
વાની તથી ગળવાની શક્તિ હોય, તે પુદ્ગલાસ્તિકાય^૧ કહેવાય છે.
જીવ અને પુદ્ગલને હાલવા ચાલવામાં મહદ કરે તે, ધર્માસ્તિ-
કાય; જીવ અને પુદ્ગલને સ્થીર રાખવામાં મહદ કરે, તે અધર્મા-
સ્તિકાય; જીવ અને પુદ્ગલને અવકાશ આપે, તે આકાશાસ્તિ-
કાય; અને જે નવી વસ્તુને જુતી કરે, અને જુનીને નવિ કરે,
તે કાળ કહેવાય છે.

નિયમચંદ—ભાઈ મોતીચંદ ! હુવે મને કાંઈક સમજણું
પડી.. તેસે માટે તારો આલાર માનું છું:

સારણોધ.

મોતીચંદ અને નિયમચંદ બંનેની યાસેથી શો આધારેવા-
નો છે ? તે વિદ્યાર્થીએ પોતાની મેળેજ વિદ્યારી દેવું. મોતીચં-
દ જેમાં નિયમચંદને સમજણું પાડવા મહદ કરી, તેમ દરેક ધુદ્ધિ-
માન વિદ્યાર્થીએ ધીજ શીડી ધુદ્ધિવાળા વિદ્યાર્થીને મહદ કરવી
જોઈએ. જિયસયંક કેમાણતથી ધીજને પૂછી પૂછીને શીખ્યો,
તેમ સર્વ વિદ્યાર્થીએ શીખવામાં અંત રાખવી જોઈએ.

સારાંશ પ્રશ્નો.

- ૧ મોતીચંદ અને નિયમચંદ કેવા હુતા ?
 - ૨ મોતીચંદ અને નિયમચંદની વચ્ચે શી વાત થઈ હુવી ?
 - ૩ અણુવ એટલે શુ ?
 - ૪ અણુવના કેટલા લોડ છે ? તેનાં નામ આપો.
 - ૫ પુદ્ગલાસ્તિકાય એટલે શુ ?
 - ૬ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એટલે શુ ?
 - ૭ આકાશાસ્તિકાય અને કાળ એટલે શુ ?
-

પાઠ ૨૭ મો.

પુષ્યમંદ.

આઈ ધર્મચંદ ! આજે પાઠશાળામાં મોડો કેમ આવ્યો ?
 અને તારા ચેહેરા ઉપર ખુશી કેમ હેખાય છે ?

ધર્મચંદ— હાલા પ્રેમચંદ ! હું તો ખરાખર વખતસર
 આવતો હતો, ત્યાં કોઈ સુનિરાજ મને સામા મળ્યા, મેં તેમને
 સુછણું, તમારે શું બેઇચે છીએ ? સુનિચે કંધું કે અમે ચિ-
 હાર કરતા આવીએ છીએ, અને ઉત્તરવાને માટે જગા લેઇએ છીએ.
 તરતિજ હું પાછો વળ્યો, અને તે સુનિને મારે ઘેર લઈ ગયો.
 તેમને આહારપાણી આપી, મારા એક લુના ધરમાં ઉતારી,
 ચુંધાને બીજાનું અને લુગાં આપ્યાં. તે સાથે મેં તેમની સુતિ

અને સેવા કરી. છેવટે બે હુંથે નમસ્કાર કરીને તરત પાઠ લામાં આવ્યો. તેટલી વાર રોકાવાથી મને વિલંખ થઈ છે. આ મારાથી આવું સારં પુષ્ટયતું કામ થયું, તેથી મારા જાહેરા ઉભુશાલી તરી આવી છે.

ગ્રેમચયંડ્ર—“હાલા ભાઈ ! તે પુષ્ટયતું કામ છે, એ તેં શી રીતે જાણ્યું ?

ધર્મચયંડ્ર—ભાઈ ગ્રેમચયંડ્ર ! મુનિરાજની સેવા કરવી, મજ ગમે તે કોઈ દુઃખી હોય, તેને મદ્દ કરવી, તે ઉં કહેવાય છે. તે પુષ્ટય નવ રીતે થાય છે. તે નવે રીત આ મારે હુંથે થઈ, તેથી મને વધારે ખુશી ઉપને છે.

ગ્રેમચયંડ્ર—તે પુષ્ટયની નવ રીત કઈ તે ઓળખાવીશ

ધર્મચયંડ્ર—૧ લુખ્યાને અન્ન આપવું. ૨ તરખાને પાંચાવું. ૩ અનાશ્રયને રહેવા આશ્રય આપવો. ૪ સુવાને પથ ચાપવી. ૫ પહેરવા ચોઢવાને લુગડાં આપવાં. ૬ તેવાને મનમાં સારા વિચાર કરવા. ૭ મોઢેથી સુતિ કરવી. ૮ કાયા સેવા કરવી, અને ૯ બે હુંથે નેરી નમસ્કાર કરવો. એ ગ્રાકારે પુષ્ટય બાંધાય છે, અને તે ધિવાય થીજાં પણ પુષ્ટય બાંધવાનાં કરતથું છે, સાટે એને પુષ્ટયબંધ કરે છે.

ગ્રેમચયંડ્ર—હાલા ભાઈ ! તારી પાસેથી આ પુષ્ટય વાત જાણી મને ધણ્ણો આનંદ થયો. હુંબેથી હું પણ હુંમે એવાં પુષ્ટયનાં કામ કરીશ.

સારણોધ.

કરેક શાવકના ખાળકે ધર્મચંદ્રની જેમ પુષ્પય બાંધવું,
અને પ્રેમચંદ્રની જેમ ખીલની પાસેથી જાંબળીને તે પ્રમાણે
બર્તવા પ્રયત્ન કરવો.

સારોશ મનો.

- ૧ ધર્મચંદ્ર અને પ્રેમચંદ્રને ક્યાં વાતચીત થઈ હતી ?
 - ૨ ધર્મચંદ્ર પાઠશાળામાં મીડા આવ્યો તેનું શું કારણ
હતું ?
 - ૩ પુષ્પય બાંધવાના કેટલા પ્રકાર ?
 - ૪ ધર્મચંદ્રે પુષ્પય કેટલે પ્રકાર અને કેવી રીતે બાંધવું
હતું ?
 - ૫ આ પાઠનો સારણોધ શું ?
-

પાઠ ૨૮ મો

પુષ્પય બાંધવાની નવ રીત.

ઇચ્છા.

ઘૂમ્યાને હેઠળ, તરસ્યાને હે યાણી,
ઉત્તરથા હે સ્થાન, સ'ત કે સંલગ્ન લાણી;

બિછાવી આપે સેજ, વસ્તુની તંગી ભાગે,
શુલ ચિંતન હિલમાંથી, બોલ પ્રિય મુખ્યથી ભાગે.
બળી સેવા નમન કરે ધણું, જાણી વ્યવહાર ધર્મને;
એવા શ્રાવક રતનો સમા, બાંધે પુન્યના કર્મને.



પાઠ ૨૮ મો.

પુષ્યનું પ્રણ.

છોકરાઓ—મહેતાળ સાહેબ ! ગાઈ કાલે અમે બધા
છોકરાઓએ જાતજાતની કસરત કરવા માંડી, તેમાં કેટલાએક
હંપ્તી ગયા, કેટલાએક પડી ગયા, અને કેટલાએક ચાકી ગયા,
પણ આ વાડીલાકને કાંઈ જણાયું નહીં. દરેક કસરતમાં તે
આગળ પડ્યો, અને તેના શરીરને કાંઈ પણ હુક્તાં આવી
નહીં. અમે બધા તેના જેવડા છીએ, અને જણુવામાં સાથે છીએ,
તે છતાં તેના જેવી તંહુરસ્તી અમારામાં કેમ નહીં હોય વાર્તા ?

મહેતાળ—છોકરાઓ ! તમે કદ્દુ, તે બરાબર છે, તમારા
બધાઓમાં વાડીલાક તંહુરસ્ત છોકરો છે, તેનું કારણ તેનાં
પુષ્ય છે.

છોકરાઓ—શું પુષ્યથી તંહુરસ્ત થવાય છે ?

મહેતાળ—હા, પુષ્યથી તંહુરસ્ત થવાય છે, એટલુંજ
નહીં, પણ પુષ્યથી ખીજાં પણ માણી જાતનાં સુખ મળે છે.

છોકરાયો—સહેખ ! પુષ્ટયથી શુશું થાય ? તે કહો.

મહેતાળુ—પુષ્ટયથી લાવ સુખશાતામાં રહે છે, ઉચ્ચા કુળમાં જન્મે છે, શરીરે તંહુરસ્ત રહે છે, શરીરની બધી ઈદ્રિયો નરવી રહે છે, હાથ, અગ વિગેરે અંગ મજબૂત થાય છે, શરીર સુંવાળું ને ગોડું રહે છે, શરીરનું વજન નેઘણે તેલું થાય છે, શ્વાસોશ્વાસ સારી રીતે લઈ થકાય છે, ફુનિયામાં ખોકગિય થવાય છે, કંઠનો સ્વર સારો ભીઠાશવાળો રહે છે, લોકમાં સારી આંદ્ર વધે છે, યથ ફેલાય છે, અને એવટે લીર્ધેકરની પહુંચ પણ મળી શકે છે.

છોકરાયો—મહેતાળુ ! પુષ્ટયથી એટલું બધું સારું થાય છે, એ વાત તો અમે આન્જેજ બાણી. અમે તે બાણીને ધલ્યા ખુશી થયો છીએ, અને તમારો આલાર માનીએ છીએ. આંજથી અમે બધા હુમેશાં ખની શકે તેટલું પુષ્ટયનું કામ કરીશુ.

સારયોધ.

મહેતાળુ અને છોકરાયો વચ્ચેની આ વાત હૃપદી સંસારમણ છે કે, પુષ્ટયથી ડેટલું બધું ભલું થાય છે ? એ બાણી હરેક છોકરાયો પુષ્ટયનાં કામ કરવાં.

૨ સોઝેમાં જન્મને ગમે તેવો અવાજ છે.

સારાંશ પ્રમેલા.

- ૧ વાડીલાલ તંહુસ્ત હતો, તેનું શું કારણ ?
 - ૨ પુષ્યથી શું શું થાય, તે કહો.
 - ૩ મહેતાળનો આલાર માની છોકરાઓએ શું કશવાળું અખુલ કર્યું ?
-

પાઠ ૩૦ મો.

પાય.

રામનગરમાં એક શ્રાવકે જૈન પાઠશાળા સ્થાપી, તે યાઠ-
જા ઉપર તેણું એક સારા માસ્તરની નીમણુક કરી, અને તે
સ્તરને જણાયું. કે, તમારે પાઠશાળામાં જુદા જુદા બે વર્ગ
ડવા. પહેલા વર્ગમાં જે સારા છોકરાઓ હોય, તેમને રાખવા
ને ધીજા વર્ગમાં જે નહારા છોકરા હોય, તેમને બેસાડવા. જે
એ છોકરાનો વર્ગ હતો, તેમાંથથી છોકરાઓ એકઢા થયા.
ઈનહારા વર્ગમાં ગયું નહિં, ત્યારે માસ્તરે આવી કર્ણું કે, જે
દારા છોકરા હોય, તે ચેલા ધીજા વર્ગમાં બેસો, અને સારા
કરા હોય, તે અહું બેસી રહો. તે માંહેથી એક ગોવિંદ નામનો
કરા ઉલો થઈ ભોલ્યો. માસ્તર સાહેબ ! સારા છોકરા કયા,
ને નહારા છોકરા કયા, તે શી રીતે જણાય ? માસ્તરે કર્ણું,
પાપી હોય, તે નહારા છોકરા કહેવાય છે, અને જે પાપી

ન હોય, તે ચારો એકરો કહેવાય છે. ગોવિંદે ન અતાથી જગ્યા
માસ્તર સાહેબ ! પાપી કોણુ કહેવાય ? તે અમને સમજાવો.

માસ્તર—એ અદાર જાતનાં નહારાં કામ કરે, તે ખા
કહેવાય છે, અને કે તેવાં કામ ન કરે, તે પાપી કહેવાતો ના

ગોવિંદ—એ અદાર જાતનાં નહારાં કામ કર્યાં તે સમજાવરે
માસ્તર—હું સાંભળો. ૧ કોણ પણ લુધના પ્રાણુનો ન
કરવો. ૨ એહું બોલવું. ૩ ચારી કરવી. ૪ વ્યલિયાર કરવી
ય કોથથી ધર્યું ચીજનો સંશહુ કરવો. ૬ શુસ્તો કરો
૭ અહું હાર રાખવો. ૮ કષટ કરવું. ૯ કોષ કરવો. ૧૦ વે
માણુસ અથવા ચીજમાં ગ્રીતિ લેડવી. ૧૧ દ્વેષ કરવો. ૧૨
લુચો ટંટો કરવો. ૧૩ એહું આળ ચડાવવું. ૧૪ ચારી ખા
૧૫ ગ્રીતિ અગ્રીતિ કરવી. ૧૬ ધીજની નિંદા કરવી. ૧૭ ક
દશી એહું બોલવું. અને ૧૮ મિદ્યાત્વશાલ્ય હૃદયમાં રાખ
આ અદાર દીતે યાદ બંધાય છે, તેથી તેમ કરનારા એકં
પાપી ગણી નહારા વર્જમાં દાખલ કરવો પડે, અને કે રો
પાપી નહીં હોય, તેને ચારો વર્જમાં દાખલ કરવો પડે.

તે સાંભળી ગોવિંદ અને ખધા એકરાચ્યો બોલી ઉઠ
આ અદાર જાતનાં યાદ તો સાધુ મહારાજથી સુડી શકાય.

માસ્તર—એકરાચ્યો ! કેમાં તમારી મતલબ ન કર
હોય, તેમ તમારાં સગાં ચંબાધીનું કામ પણ ન હોય, તે
નહામી દીતે તેવાં યાદ ન કરાં જોઈએ, અને તેની મર્યાદ
રાણવી જોઈએ.

છોકરાયો—તે કેવી રીતે મર્યાદા રાખવી ?

માસ્તરે—તે અમોને હું હુલે પછી સમજાવીશ.

છોકરાયો—બહુ સારું માસ્તર સાહેબ ! હુલે અમે તેવાં પાપ જનતાં સુધી કોઈ રીતે નહીં કરીએ, અને બહુ વિચારીને દરેક કામમાં વર્તશું, કે જેથી અઠાર જાતનાં પાપ અમોને લાગે નહીં.

પછી બધા છોકરાયો એવી રીતે વર્તવા લાગ્યા કે, કોઈ છોકરે તે નહારા વર્ગમાં આંદોલ નહીં, અને છેલ્ટે માસ્તરે નહારા છોકરાના વર્ગને તદ્દન કાઢી નાખ્યો. વાઢ વાઢ ! ! એ કેવા લાગ્યા છોકરા ! !

સારથોધ.

છોકરાએ હમેશાં સારા થવું. અઠાર પ્રકારે પાપ થાય છે, તે બાત જ્યાનમાં રાખી કદિ પણ પાપી થવું નહીં. પાપી થવાથી નહારા છોકરાના વર્ગમાં ગણ્યાએ છીએ.

સારાંશ પ્રશ્નો.

૧ રામનગરની પાઠશાળામાં કેટલા વર્ગ પાડ્યા હતા ?

અને તે યાડવાને હેતુ શું હતો ?

૨ પાપ કેટલી રીતે બધાય ? તે કણો ?

જ પાપના ખધા પ્રકાર કેવી રીતે છે ? તેના હુંકારો
સાર કહો.

પાઠ ઉંમો.

પાપનું હળ.

જગુ નામનો ઓછ નાનો છાકડો દાતો દાતો નિશાળેથી
ધરે આવ્યો. તેના ણાપાંચો કહું કે, બેટા ! કહે, શામાટે રડે છે ?

જગુ—ખાપા ! આજે માસ્તરે મને કહું કે, જગુ !
તારાથી કોઈ એવું પાપ થયું છે કે, જેનાથી તને વિધા અડતી
નથી ? માટે હુંએ કાંઈ પણું પાપ કરીશ નહિ. નહિ તો ખાણો
આવતો જન્મમાં તું મૂર્ખ થઈશ. ખાપા ! આ પ્રમાણે માસ્તરના
કહેવાથી મને ખહુ ગોઢું લાગ્યું, પણ તે વખતે હું કાંઈ બોલ્યો
નહિ. કારણું કે, તમે મને શીળંઘું છે કે, માસ્તર એ વિધા
આપનાર શુરૂ કહેવાય, તેથી તેઓ કે કહે, તે સાચું માનવું,
અને તેમની સામે કહિ પણ બોલવું નહીં. પછી નિશાળમાં રજ
થઈ, એટલે હું વેર આવવા નીકળ્યો; ખાં કેટલાંચેક નહારા
છાકડાઓ મને પાપી કહેવા લાગ્યા; આથી મને ગોઢું લાગ્યું,
અને હું દાતો દાતો અહું આવ્યો.

ખાપા—તારા માસ્તરે કે વાત કઢી છે, તે સાચી છે.
હરેક પ્રાણીને કરેલું પાપ કોગવવું પડે છે. તને કે નહારા
છાકડાંચે પાપી કહ્યો, તે સારુ કર્યું નહીં. કાઈ પણ માણુસને

આપી કે નઠાડો કહેયો, તે ઠીક ન કહેવાય; તેમ કહેવાથી પણ
પાપ લાગે છે.

જગુ—આપા ! આપણે પાપ કરીએ, તેતું શું શું નઠાડે
ક્રષ્ણ મળે, તે અને સમજાવશો ?

ધૂપા—હા સાંલળ. કરેલું પાપ ખ્યાસી પ્રકારે લોગવાય
છે, તેમાં જે સુખ્ય આખત છે, તે ધ્યાન આપી સાંલળને. જે
પાપ કર્યું હોય, તો બુદ્ધિ ઓછી થાય છે, અને તેથી વિદ્યા
ચર્ચાની નથી. તેને જ્ઞાનમાં આંતરાય, એટલે અડચણો આવે છે.
કોઈ માણુસ તેને કોઈ જતની મહદ્દ આપતો નથી, તેના
ધરમાં પૈસો હોય, તે છતાં તે કોઈને આપી શકતો નથી, તેનાથી
કોઈ જતનાં સુખ મેળવાતાં નથી, તેને જેઠતી ચીજ મળતી
નથી, તેનામાં શક્તિ છતાં તેનો તે સારો ઉપયોગ કરી શકતો
નથી, તેને હંધ તથા સુસ્તિ બહુ રહે છે, તેનો જનમ હુલકા
કુળમાં થાય છે, સર્વને તે અળળામણો લાગે છે, તે નરકમાં
યડે છે, તેના શરીરમાં અનેક જતના રોગ થાય છે, અને તેતું
શરીર નખણું રહે છે—પાપી માણુસની આવી અવસ્થા થાય છે;
એ વાત ધ્યાનમાં રાખી તું કોઈ દિવસ પાપતું એક પણ કામ
કરીશમાં, અને થીજાને પાપતું કામ કરવા જોધીશમાં.

જગુ—આપા ! તમે કહ્યું, તે મારા મનમાં ઉત્તેંદું છે,
હુદેથી હું કદિ પણ પાપ કરીશ નહિ, તેમજ કોઈની પાસે
કરાવીશ નહિ, તેમજ જે પાપ કરતા હોય, તેને એકો આપીશ
નહિ, પણ તે પાપ કરતાં અટકે ચેવું કરીશ.

સારષોધ.

જેમ જગુંયો પોતાના ખાપની શીખામણુ માની પાપ ન
કરવું; અવો નિશ્ચય કર્યો, તેમ દરેક શ્રાવકના છોકરાએ તેમ
કરવું નેહાયો, અને પાપ કરવાથી કેવું નહારું ફળ મળે છે,
તે વાત ધ્યાનમાં લેવી નેહાયો.

સારંશ પ્રશ્ના.

૧ જગુ રૈતો રૈતો ઘેર આવ્યો, તેનું શું આરણુ ?

૨ જગુ પોતાના માસ્તર પાસે કેવી રીતે વત્યો હુતો ?

૩ પાપ કેટલે પ્રકારે લોગવાય છે ?

૪ પાપ કરવાથી કેવું નહારું ફળ મળે છે ? તેનું કુંકું
વર્ણન કરો.

૫ જગુએ પોતાના ખાપ પાસેથી કેવી શીખામણુ લીધી હતી ?

પાઠ તરંગો.

આશ્રવ.

ગુડુ—શિષ્યો ! આજે તમને આશ્રવને માટે સમજાવું એ
ખાત ધ્યાનમાં રાખજો; જેમ કેાધ તળાવમાં નાણાં વાટે સારું
જરૂરું પાણી આવે છે, તેમ જીવની અંદર સારાં અને નરતાં
કુર્મે આવે છે. લુલ એક તળાવ છે, શરીર, લુલ, નાક, અંધુ

અને કાન એ પાંચ ઈદ્રિયો, તે તેનાં નાળાં છે, અને કર્મ પાણીને ડેકાણું છે; જે આપણે સારાં કે નઠારાં કર્મ કરીએ, તે કર્મરૂપી પાણી પાંચ ઈદ્રિયોદ્વારા નાળાં પ્રાણે જીવરૂપ તળાવભાં દાખલ થાય છે. સારાં કર્મના આશ્રવથી પુષ્ટ બંધાય, અને નઠારાં કર્મના આશ્રવથી પાપ બંધાય છે. જે આપણે શરીરથી રસારું કામ કરીએ, જીબથી સ્ત્રારું બોલીએ, અને કાનથી શાસ્ત્ર સાંભળીએ તો, આપણે સારાં કર્મના આશ્રવથી પુષ્ટ બંધીએ છીએ, અને જે શરીરથી રનઠારું કરીએ, જીબથી નઠારું બોલીએ; અગર ન આવાનું બાધાએ, તો આપણે નઠારાં કર્મના આશ્રવથી પાપ બાંધીએ, તેવી રીતે શુસ્તસો, અભિસાત, ક્રમટ અને દોષ લાલચ રાખવાથી પણ પાપ બંધાય છે.

શિષ્યો—શુરૂ ! તે પાંચ ઈદ્રિય શિતાય આશ્રવના બીજ પ્રકાર હુશે કે નહીં ?

શુરૂ—હા, બધા મણીને આશ્રવના બેંતાળીશ લેદ થાય છે, તે હું તમને બીજ વેળાએ સમજવીશ.

સારથોધ.

આ પ્રમાણે આશ્રવની સમજણું લઈને દરેક શ્રાવકના પુત્રે નઠારા આશ્રવને છોડી હેવા જોઈએ.

૧ જેથી મનના વિચાર નઠારા ન થાય, તેમજ બીજ જીવને હૃદ્ય ન થાય તે. ૨ જેથી મનના વિચાર બગડે, અને ક્રાંકું કામ કરવાતું મેન થાય, અતે બીજા જીવને હૃદ્ય થાય તે.

સારાંશ પ્રશ્નો.

૧ આશ્રમ એટલે શું ? તળાવને કોણી સાથે સરખાવવું ?

૨ પાણી અને નાળાંની સાથે કોણી સરખામણી થાય ?

૩ સુષ્પય અને માય કેવી આશ્રમથી ભાગાય ?

૪ આશ્રમના ધધા મણીને કેટલા ભક્તાર છે ?

પાઠ ૩૩ મો.

સંવરો.

વિહૃલદાસ નામનો એક છોકરો હતો. તે ધણેણ ધર્મી અને નિયમ અમાણે કામ કરતારો હતો. તે દરરોજ કેરે જતો, અને ઉપાશ્રયે શુરૂના ચુખનો ભોગ સાંભળી ગાછે વેર આવી નિશાળે જતો. એક વખતે સેણે વેર આવી મુછચું, બાપા ! આજે હું ઉપાશ્રયે ગયો હતો, ત્યાં કોઈ તપસી મુનિનાં મારે હર્શન થયાં. તેમની હુખળી કાયા નેઈ મને વિચાર થયો કે, સાધુઓ શામાટે આટલા ખધા હુંઘી ધતા હુયો ?

બાપા—લાઈ વિહૃલ ! તું આમ ઈમ પુછે છે ? તું નંતર તત્ત્વ જાણ્યો છું. કે નહિ ?

વિહૃલ—હા, બાપા ! હું જાણ્યો છું, પણ મને કોઈ ડેકાળું અરાધાર સમજ્યું પડી નથી, માટે સમજાવેલું.

ભાપા—સંવર એટલે શું ? તો તું જાણે છો !

વિકુલ—ના, મને બરાબર સમજણું પડી નથી, તે સમજાવો.

ભાપા—જે આપણે હુમેશાં કાંઈ પણ સારાં નરતાં કામ કરીએ, તેનાથી કર્મ બાધાય છે. તે બાધાતાં કર્મ જેનાથી રોકાય, તે સંવર કહેવાય છે. કર્મને રોકાવનાર સંવર કરવામાં ધણી મહેનત છે, તે સાધુ કે તપસીજ કરી શકે છે. બુખ, તરફ, ટાદ, ગરમી, હાંસ અને હોગ વિગેરે આવીશ પ્રકારના પરીક્ષણ એટલે હુઃખુઃ સહુન કરવાથી સંવર થઇ શકે છે, તે જિવાય થીજા સંવરના સત્તાવન લેદ પણ કહેલા છે.

વિકુલ—ભાપા ! શું તે સાધુજ તેવા પરિષહનો સહુન કરી સંવર કરતા હુશે ?

ભાપા—હા, સુનિયો તેવું કરી શકે છે, તેં જે સુનિને હુઃખુઃ ભી જોયા, તે પણ તેવાજ સમજવા.

વિકુલ—ભાપા ! ધન્ય છે, તેવા સુનિને હુદે હું તેમને હુમેશાં વાંદવા જઈશ..

સારથોધ..

વિકુલદાસની જેમ દરેક છોકરાએ દેવગુરુનાં દર્શિનું કરવા, અને સંવરનો અર્થું સમજું સારી લાવના લાવવી.

૧ અમતાથી રાગ, દ્વાષ કર્યા જિવાય સહુન કરવાથી.

સારાંશ પ્રક્રિયા.

- ૧ વિદૃગદાસ કેવો છોકરો હતો ?
 - ૨ સંવર એટલે શું ?
 - ૩ પરિપિહમાં શું શું સહૂન કરવું જોઈએ ?
 - ૪ સંવરના ફેટલા લેદ છે ?
-

પાડ ત૪ મો.

નિર્જરા.

ચંહુલાલ નામનો એક છોકરો દરરોજ દેરે દર્શિન કરીને ભતો હતો. ગમે તેથું આરણુ હોય; તોપણુ તે પ્રભુનાં દર્શિન રીતા વિના રહેતો નહીં. એક વખતે મોહનલાલ નામનો એક ગિલે છોકરો, જે તેનો મીત્ર હતો, તેને ઘેર ચંહુલાલ આવ્યો. ચંહુલાલે કલું, લાઇ મોહનલાલ ! તારા ખાપા ક્યાં છે ?

મોહનલાલ—મારા ખાપા ઘરમાં છે. તારે શું કામ છે ?

ચંહુલાલ—મારે તેમને કાંઈ પુછવાનું છે.

મોહનલાલ—શું પુછવાનું છે ?

ચંહુલાલ—તારા ખાપાને ધર્મનું જ્ઞાન સાંચ છે, તેથી મારે એક શાંકા પુછવાની છે.

પણી મોહનલાલને ચંહુલાલ પોતાના ખાપની પાસે ઘરમાં રદ્દ ગયો. મોહનલાલના ખાપાનું નામ નિનદાર હતું.

ચંહુલાલ—જિનદાસ કાકા ! કોઈ પણ પાપ કાગે તો
શું કરવું ?

જિનદાસ—તે ડેવું પાપ છે ?

ચંહુલાલ—ભુલથી જુહું ખોલવાનું પાપ થયું હોય, તો
શું કરવું ?

જિનદાસ—તેનું શુરૂ પાસે ગ્રાયશ્રિત હેવું.

ચંહુલાલ—કાકા ! ગ્રાયશ્રિત લેવાથી પાપ ચાલ્યું જશે ?

જિનદાસ—હા, ગ્રાયશ્રિત એ તપ કહેવાય છે.

ચંહુલાલ—તે ડેવી રીતે તપ કહેવાય ? તે સમજવો.

જિનદાસ—નિર્જરા નામે એક તત્ત્વ છે. નિર્જરા તપ
કરવાથી થાય છે. તપ બાર પ્રકારનાં છે: છ ખાદ્ય એટલે ૧શા-
રીરિકિ. અને છ આલ્યંતર એટલે ૨માનસીક. ૧ ઉપવાસ,
૨ ઓછા આહાર ઉદ્ધુકામાં નિર્વાહ, ૩ ઉચાંણીલનીવી, ૪ ઝુકાય-
કલેશ; અને ૬ પચંગ સંકોચયવું એ છ ખહારનાં તપ છે.
અને ૧ ગ્રાયશ્રિત, ૨ વિનય, ૩ વૈયાવચ્ચ, ૪ લષ્ણવું લષ્ણવિષાં
૫ ધ્યાન અને ૬ કાયા વિગેરે પર વસ્તુનો ત્યાગ—એ છ અ-
દરનાં તપ કહેવાય છે. એ બારે પ્રકારનાં તપથી નિર્જરા થાય છે.

ચંહુલાલ—કાકા ! તમે એ ખહું સારી રીતે સમજાયું,
તેને માટે હું આપનો આલાર માનું છું:

૧ શરીર જેનાથી તપે. ૨ મન જેનાથી તપે. ૩ દુધ, દાઢી, ગોળ
વિમેરનો ત્યાગ. ૪ કાયાને ધર્મને અથે દુઃખ દેવું. ૫ વગરકારણે ૨ખડવું નહિ.

પદી ચંહુલાલ શુરૂ આસે પ્રાયશ્ક્રિત લઇ શુદ્ધ થયો.

સારણોધ.

હરેક છોકરે ચંહુલાલની ખેડે હરે જવું, અને પાય લાગ-
વાથી આલોયણું લઇ કરેલાં કર્મની નિર્જરા કરવા તત્પર થવું.

સારાંશ પ્રશ્નો.

૧ ચંહુલાલ ડેવો છોકરો હતો ? તે કહો.

૨ નિર્જરા એટલે શું ?

૩ તત્પના બધા મળીને કેટલા પ્રકાર છે ?

૪ અંદરનાં અને આહેરનાં તપ ગણુવો.

પાઠ ઉપ મો.

બાંધ.

ઓક વળતે કેટલાએક શિષ્યો શુરૂની આગળ આવી કહેવા
લાગ્યા કે, શુરૂ મહારાજ ! અમને બાંધનો અર્થ સમજાવયો ?

શુરૂ—શિષ્યો ! તમે ધ્યાન દઈને સાંશળ્યે. કર્મનો જીવની
સાથે કે બાંધ થાય, તે બાંધ કહેવાચ છે. કેમ હુધ અને
પાણી મળી લય છે, તેમ કર્મનાં પુદ્ગળ જીવની સાથે મળી
લય, તે બાંધ કહેવાય છે. કેમ કેવી બાંધીઆને સ્વતંત્ર રહી

જાકતો નથી, તેમં આરમા કર્મના અંધથી સ્વતંત્ર રહી શકતે નથી. તે અંધના ચાર લાગ પડે છે. કર્મનો સ્વભાવથી અંધ તે ઘેણેદો પ્રકૃતિ અંધ કહેવાય છે. અમુક કાળ સુધી કર્મને અંધ, તે ખીંલે સ્થિતિ અંધ કહેવાય છે. કર્મનો ઓછો વધતો અનુભવ થાય તે ખીંલે અનુભાગ અંધ કહેવાય છે, અને કર્મન પુદ્ગળ ઓછાં વધતાં હોય, તે ચોથો પ્રદેશ અંધ કહેવાય છે તેના ઉપર તમને એક દાખલો સમજવું, તે સાંસળો. આખ બુંદીના લાડવાનો એક ધાણુવો નાખયો, અને તે લાડવા આંધ્ય હોય, તેમાં કેટલાક લાડવા પીત્ત કરતા અને કેટલાક વાત કરત થાય છે, તે પ્રકૃતિ (સ્વભાવ) કેટલાક લાડવા તરત અવા છે, કેટલાક અમુક દિવસ પછી અવાય છે, તે સ્થિતિ (કાળ કેટલાક લાડવામાં ગળપણું, ધી વિગેરે વિશેષ હોય, કેટલાકમાં ઓછું હોય તે રસ (અનુભાગ.) કેટલાક લાડવામાં બુંદી વધા હોય, કેટલાકમાં ઓછી હોય, તે પ્રદેશ અંધ કહેવાય, તેમન કર્મના અંધમાં સમજવું. ગુરુનાં આ વચનો સાંસળી શિષ્યે બુશી થઈ ગયા, અને તે વિષેનો વિચાર કરી હુમેશાં તેનું મુનન કરવા લાગ્યા.

સારખોધ.

જેમ અહીં ગુરુના કહેલા અંધતત્વના ખુલાસાથી, તેન

શિષ્યો અરણર સમજને તેનુંજ મનન કરવા લાગ્યા, તેમ દરેક
શ્રાવકના પુત્રે બાધતત્વની સમજુતી મેળવી તેવું મનન કરવું.

સારાંશ પ્રશ્ના.

૧ બાધ કાને કહેવાયે ? તે દાખલો આપી સમજવો.

૨ બાધને લઇને લાવ ડોની માઝક સ્વતંત્ર રહી શકતો નથી ?

૩ બાધના કેટલા પ્રકાર છે ? તેની સમજુતી સાથે નામ આપો.

૪ બાધમાં દાખલો શું છે ?

પાઠ ઉદ્દેશો.

મોદ્દ.

હીરલુ નામનો એક છોકરો પોતાના ન્યાયચંદ નામના
મિત્રને વેર ભળવા ગયો. ન્યાયચંદ હીરલુને લેધને પુછ્યું,
બહુલાલાઈ ! આજે કયાંથી આવો છો ?

હીરલુ—લાઈ ન્યાયચંદ ! હું ઉપાશ્રેણી ગયો હતો. ત્યાં
મોદ્દ તત્વને માટે મુનિ મહારાજાએ મને સારી રીતે સમજવ્યું,
તે તને કહેવાને માટે હું આવ્યો છું.

ન્યાયચંદ—લાઈ ! તે તું અરણર સમજવો છું ?

હીરલુ—હા, મારી ખુદ્દી પ્રમાણે તો અરણર સમજવો છું ?

ન્યાયચંદ—ત્યારે જે હું પુછું, તે બધું ખરાખર સમજવીશા?

હીરળ—હા, ભાઈ ! જે તારે પુછું હોય તે ખુરીથી પુછ.

ન્યાયચંદ—મોક્ષ એટલે શું ?

હીરળ—આ હુનિઆમાં સારાં નરસાં કર્મમંથી છુટી લુંબ
પોતાના શુદ્ધ સ્વરૂપને પામી કર્મથી છુટો થાય, તે મોક્ષ કહે-
વાય છે.

ન્યાયચંદ—મોક્ષનું સ્વરૂપ સમજવાને કોઈ રીત છે કે નહિ ?

હીરળ—હા, તેનાં નવદ્વાર કહેવાય છે, તે નવદ્વારથી
મોક્ષનું સ્વરૂપ સમજાય છે.

ન્યાયચંદ—તે દ્વાર કેવી રીતનાં છે તે કહો ?

હીરળ—જેમાં છતાં પદની પ્રરૂપણા હોય, એટલે મોક્ષ
એ એક પદ છે, અને વાચક છે જે એક પદ વાચક હોય,
તેનો વાચ્ય અવશ્ય હોવો જેઠાં એમ સાખીત કરવો, તે સત્ય
પ્રરૂપણા નામે પેહેલું દ્વાર છે ? મોક્ષના લુંબ એટલા છે ? તેનો
વિચાર કરવો તે બીજું દ્વાર છે અમાણું દ્વાર છે. મોક્ષના લુંબને
રહેવાનું ક્ષેત્ર એટલું છે ? તેનો વિચાર કરવો, તે ત્રીજું ક્ષેત્ર
દ્વાર છે. મોક્ષના લુંબ એટલા આકાશના લાગને કરશો ? એવો
વિચાર કરવો, તે ચીથું સ્પર્શના દ્વાર છે. મોક્ષના લુંબને
કાળ આદિ અને અનંત છે, અને અનેક સિદ્ધ આસરી અનાદી
અનંત છે, એક સિદ્ધ આસરી, એવા વિચારને ખાંચસું કાળ
દ્વાર કહે છે. મોક્ષના લુંબની વર્ણણ અંતર નથી, એમ વિચારનું,

તે છિકું આ'તર્દીએ છે. મોક્ષના લાવ સા'સારી જીવને અનંતમે લાગે છે, એવો વિચાર તે સાતમું લાગદ્વાર છે. મોક્ષના જીવની આ'દર એકાધિક લાવ છે, ધીજી લાવ નથી, એમ વિચારવું, તે આઠમું લાવદ્વાર છે. મોક્ષના જીવો પા'દર પ્રકારના છે, તેમાં કુચામાં શોરા અને કુચામાં ઘણું છે, એમ વિચારવું, તે અદ્ય એહુત્વ નામે નવમું દ્વાર છે. આ ગ્રભાણે નવદ્વારથી મોક્ષતું સ્વરૂપ સમજાય છે. લાઈ ન્યાયચંદ્ર ! આ બંધાનો વિચાર કરીશ, એટલે તને મોક્ષતું સ્વરૂપ બરાખર સમજાશો, અને આમાં કે વિશેષ સમજવાનું છે, તે પાછળથી સમજવીશ.

ન્યાયચંદ્ર—લાઈ હીરણ ! હું સારી રીતે સમજ ગયો. મને મેહનત લઈ સમજાવ્યો તેને માટે તમારો ઉપકાર માનું હું, પછી ન્યાયચંદ્ર ઘુશી થતો પોતાને ઘેર ચાલ્યો ગયો.

સારખોધ.

દ્વદેક શ્રાવકના છોડકરાયે મોક્ષતું સ્વરૂપ સમજવાને માટે ન્યાયચંદ્રની કેમ હેંશ રાખવી, અને સમજવનારનો આલાર માની પોતાના કામમાં તત્પર રહેવું.

સારાંશ પ્રશ્નો.

- ૧ હીરળ અને ન્યાયચંહ કેવા મિત્ર હતા ? અને ન્યાય-
ચંહ હીરળને ઘેર શામાટે ગયો હતો ?
- ૨ મોક્ષ એટલે શું ?
- ૩ મોક્ષ સમજવાના ઉપાય શું છે ?
- ૪ મોક્ષ સમજવના ઉપાયનાં નામ આપો.
- ૫ લાવદ્વાર, અંતર્દ્વાર, સત્પદપ્રેર્યણુદ્વાર અને સ્પર્શનાદ્વાર
વિષે સમજવો.
- ૬ મોક્ષના જીવ કેટલા છે ? મોક્ષના જીવનો કાળ કેવી
રીતે છે ? અને મોક્ષના જીવ સંસારી જીવને અનંતમે લાગે છે,
એવો વિચાર કયા દ્વારમાં થાય છે, તેના નામ આપો.

॥ સમાપ્ત. ॥

જૈન ધર્મ પહેલી ચોપડી.

(જૈન ધર્મ વાંચનમાળાનું પહેલું પુસ્તક છપાઈ ખણાર પણું છે.)

જૈન ધર્મનું જ્ઞાન બાળકોને સરળતાથી મળે, એ હેતુથી “ જૈન ધર્મ વાંચનમાળા ” પ્રસિદ્ધ કરવાનો ઠરાવ કર્યો છે. નવકાર મંત્રથી આરંભી ણીળ ધર્મ તત્ત્વના વિપયો બાળકોની શક્તિ અનુસાર અને તેમનાથી સમગ્લય એની લાપામાં વર્ણિત્વા છે. વિષયોના પાઠે લાગ પાડ્યા છે. આ પ્રથમના પુસ્તકમાં પ્રવિદ્ધમણું, પુનલિખિં, છુંબિયાર, આચારોપદેશ, ચારિત્ર, વિગેર વિપયો સરલ અને વિસ્તારપૂર્વક વાખ્યા કરી વર્ણિત્વા છે. દરેક પાઠને અતે સાંસદ્ધ પ્રશ્નો આપવામાં આવ્યા છે, જે દ્વિક્ષક અને શિષ્ય બંનેને ઉપયોગી છે. આ પુસ્તક તૈયાર કરવામાં મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ચારિત્રવિજયજીએ ધર્મિ અમૃત્ય સદ્ગ્ય આપેલી છે. પુસ્તક ડેમી ૮ પેશ ૧૬૦ પૃષ્ઠનું છે. બાઈડીંગ પાકું અને સુશોભિત કરાયું છે. છતાં આપણા સર્વ જૈન સાધર્મિ લાઇઓને ધર્મજ્ઞાનનો લાલ દેવા થની રહે, તે માટે કિભૂત માત્ર છ આના રાખવામાં આવી છે. તીવ્યેને શીરનામે પત્ર લખવાથી મળી રહેશે.

આવિકા લૂપણું.

આવક સંસારના ઉત્તમ ચરિત્રરૂપ બોધક નોવેલ.

ઉપરના નામનું પુસ્તક અમારી તરફથી છપાઈ પ્રસિદ્ધ યથું છે. આ મંચમાનો ચારિત્રનો વિપય ધર્ષે રસિક, બોધક અને ભનોહર છે. વળી નીતિ અને ઉચ્ચ સદ્ગુણના વર્ણનથી લરખૂર છે. કથાનો પ્રેસંગ અતિ અદ્વિષૂત ને રસિક હોવાથી વાંચનારને બહુજ પ્રિય યધ પડે તેવો છે; ઉપરાંત રથ્યો રથ્યો કથાના પ્રેસંગમાં આવક ધર્મનું રહદર્શય ઉત્તમ રીતે દર્શાવ્યું છે. લાપાપણી સરલ છે. આવિકાએને આસ વાંચવા ગોટ્ય પુસ્તક છે. પુસ્તક વાંચવાથીનું

તેની રસિકતા અને ઉત્તમતાની ખાત્રી થશે. પુસ્તકનું કહ રૈયલ ખાર પેલું છે. ઉદ્ધ પૃષ્ઠ ૪૦૮નું છે. તેનું બાઈડિગ કાપડનું પાકું અને છાપવાણું ધાર્યાં સુંદર કરાવ્યું છે. છતાં સર્વેને લાલ લેવા બની શકે તે માટે તેની કિંમત ઇકત ૧૨ આના જેટલી જુજ રાખવામાં આવી છે. પોર્ટેજ જુડું પડશે. પુસ્તક વી. પી. થી મોકલીથું. નીચેને શીરનામે લખો.

શ્રીચંદ્ર કુમાર

ચાને

આનંદ ભંદીર.

આવક ધર્મનું રહુસ્ય દર્શાવનાર ઉત્તમ નોવેલ.

ઉપરના નામનું નોવેલ અમારા તરફથી છપાઈ પ્રસિદ્ધ થએલું છે. આ અંથની વરસુ સંકળનામાં “શ્રીચંદ્ર કુમાર” ના ચરિત્રનો વિષય છે, જે અતિ ભનોહર અને બોધક છે, એટલાંજ નહિ, પણ તે વિષય એટલો તો રસિક છે કે, તે વાચવામાં ધણો આનંદ થાય છે. સિવાય શ્રી નૈન ધર્મ તત્ત્વનો બોધ થાય, એવી યોજના આ અંથમાં પ્રત્યેક સ્થળ કરેલી છે; જેથી વાચક વર્ગને આનંદની સાથે ધર્મ જ્ઞાનનો અમૂલ્ય લાલ ગ્રાસ થાઈ શકે તેબું છે. આ અંથ રૈયલ ૮ પેલું ૪૫૦ પૃષ્ઠનો સુંદર કાગળમાં અને સુંદર અક્ષરેથી છપાઈ પ્રસિદ્ધ થયો છે, અને બાઈડિગ સુશેષિત કરાવ્યું છે. વાચનારને સુગમતાથી લાલ લેવા બની શકે, માટે તેની કિંમત માત્ર રૂ. ૧૧ રાણી છે. નીચેને શીરનામે લખો. પુસ્તક વી. પી. થી મોકલશું. પોર્ટેજ જુડું પડશે.

શ્રી જૈન ધર્મ વિધા પ્રસારક વર્ગ—પાલીતાણ.

